

July 11, 2024

To, **BSE Limited**Dept. of Corporate Services (CRD)
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai – 400001.

Scrip Code: 538795 / 890195

Dear Sir / Madam,

Sub: Submission of Newspaper Advertisement for First and Final Call Notice in accordance with Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

With reference to captioned subject, this is to inform that an advertisement in connection with the issue of the First and Final Call Notice is published in the following newspapers on July 11, 2024:

- 1. Financial Express (English) National daily All Editions
- 2. Jansatta (Hindi) National Daily All Editions
- 3. Lokmitra Gujarati Vapi Edition

We are submitting herewith copy of e-clippings of the advertisement published in abovementioned newspaper for your records.

This is for your information and records.

Your Faithfully,

For, Shree Ajit Pulp and Paper Limited,

Chinmay Methiwala Company Secretary & Compliance Officer

Encl: As above

SHREE AJIT PULP AND PAPER LIMITED

Regd. Office:

Survey No. 239, Near Morai Railway Crossing,

Village Salvav, Via-Vapi, Dist. Valsad, Pin.: 396191, Gujarat, India.

Tel.: +91 260 6635700 Facsimile: +91 260 2437090 CIN: L21010GJ1995PLC025135 Works:

Survey No. 239, Village Salvav, 106, 107, 108P & 105P,

Morai, Near Morai Railway Crossing,

Via-Vapi, Pin.: 396 191, Dist. Valsad, Gujarat, India

Email : shreeajit@shreeajit.com Website : www.shreeajit.com **FINANCIAL EXPRESS**

Open market sale of rice, wheat from August 1

SANDIP DAS New Delhi, July 10

THE GOVERNMENT HAS approved sale of wheat and rice in the open market from buffer stocks for bulk buyers from next month, in a bid to improve domestic supplies and preempt rise in the prices of the two staple cereals in the coming months.

The food ministry has asked the Food Corporation of India (FCI) to start offloading wheat and rice at a price ₹2,325/quintal and ₹2,800/quintal respectively, excluding transportation, from August 1. The price for wheat is lower than its prevailing market price of ₹2,400/quintal.According to an official note, the exact quantity of grain stocks to be offloaded will be decided by FCI in consultation with the ministry after keeping the stock for requirement under the public distribution system, buffer norms and

Last year, the FCI had commenced open market sale operations from June and had offloaded a record 10 MT for

additional quantity of 2 MT.

PRICE CHECK ■The move is to

improve domestic supplies and preempt rise in the prices of the two staple cereals in the coming months



■ The government effectively has a large surplus of more than 47.49 MT of rice, against a buffer of 13.54 MT as on July 1

bulk purchasers in FY24. Inflation in wheat was 6.53% in May and due to record open market sales of wheat from the FCI stocks, inflation has been in single digit since August, 2023.

As on Tuesday, FCI has 28.04 MT of wheat stock against the buffer of 27.58 MT on July 1.An official note had stated that after meeting the requirement for the public distribution system and other welfare schemes, which is approximately 18.4 MT, sufficient stock of wheat will be available to undertake market interventions, as and when required.

In the case of rice, the government effectively has a large surplus of more than 47.49 MT of rice, against a buffer of 13.54 MT, as on July 1. The government's move to offload rice to bulk buyers through weekly eauction did not find encouraging response from the trade. Officials said there will have

to be some measure to offload huge rice stocks from the buffer including supplying to states before the new paddy procure-

ment season commences from October 1. Last month, the government had imposed stock holding limits on wheat for retailers, wholesalers, processors and big-chain retailers till March 31, 2025.

Sanjeev Chopra, secretary, department of food and public distribution said that there is no shortage of wheat and the move to impose stock holding limits would help improve supplies. Chopra ruled out lifting the export ban on wheat imposed in May 2022. According to the agriculture ministry, wheat output in the 2023-24 crop year is estimated at 112.92 MT.

Urad prices decline

Meanwhile, the department of consumer affairs on Wednesday said the wholesale prices of urad has declined 3.12% and 1.08% respectively in key markets - Indore and Delhi compared to previous week on account of robust kharif sowing and imports. "In alignment with domestic prices, the landed prices of imported urad are also on a declining trend," according to an official statement.

Budget must strive for tax certainty, push manufacturing



EN DWARAKNATH

INDIA IS WELL on the path to becoming a \$5-trillion economy by 2027, showcasing strong economic growth in the face of global uncertainty. With increasing instability on the back of an uncertain geopolitical environment globally, businesses are looking at suitable global markets that offer a market for their products, the ability to diversify their risk profiles by increasing their activity and presence, while being stable and dispute free at the same time.

The upcoming Union Budget offers India the opportunity to position itself as a global force to be reckoned with by building on the strong economic performance of the last decade. To do so, the government will need to consider some key measures to spur investments in manufac-



turing, increase innovation, provide a stable, dispute-free tax environment, and send a strong message of its intent to make the country carbon neutral by 2070.

Incentivising manufacturing

While the government launched its'Make in India'initiative in 2014, the share of manufacturing in the gross domestic product (GDP) has remained in the range of 13–16%. The dip in investor confidence in China has provided India with an opportunity to build its credentials as

theworld's manufacturing hub.

In addition to pushing through long-pending labour reforms, the government should consider extending the lower 15% corporate tax rates for new manufacturing units. This could be supplemented by considering weighted deductions for certain types of expenditures, employment-linked deductions or deductions for skill development. Additionally, facilitating low-cost debt by extending lower withholding tax rates for overseas borrowings could be beneficial. However, this will need to be balanced with the global move to

achieve a minimum level of taxation of global enterprises through the Pillar 2 framework.

A boost for services

The Budget could also consider supporting the setup of global capability centres in India, helping it move up the value chain from providing mere offshore support services to becoming one of the true centres of excellence. In this regard, the government may re-consider introducing incentives which will be crucial for positioning India as a value driver in the global market.

However, this time around the focus could be on specific new-age technologies like generative AI.

With increasing rate of cybercrimes, Centre could consider providing weighted deductions or accelerated depreciation for businesses investing in cybersecurity infra thereby ensuring data protection and fostering a secure digital environment for businesses

(The author is Partner at Price Waterhouse & Co LLP)

Shivraj meets agri ministers of UP & MP

TER Shivraj Singh Chouhan on Wednesday met agriculture

UNION AGRICULTURE MINIS-

ministers of Uttar Pradesh and Madhya Pradesh to discuss issues related to farmers and farm sector in their states. According to an official statement, Chouhan initiated statewise discussions with an aim of "rapid progress of agriculture sector in the country".

He had met state agriculture ministers of Assam and Chhattisgarh last month.

On Wednesday, Chouhan met UP agriculture minister Surya Pratap Shahi and MP agriculture minister Adal Singh Kansana here to discuss the issues of agriculture sector in their respective states.

Chouhan said, under the leadership of PM Modi, the interest of farmers and agriculture sector is paramount and the central government will continue to provide all possible assistance to states. PTI

Place: Kanpur

Date: July 10, 2024

SG FINSERVE LIMITED

Formerly Moongipa Securities Limited)

CIN: L64990DL1994PLC057941

Registered Office: 37, Hargobind Enclave, Vikas Marg, Delhi-110092

Tel: +91-120-4041400 | Fax:+91-120-4041444 | Email: compliance@sgfinserve.com | Website: www.sgfinserve.com

S.No.	Particulars	Quarter ended	Quarter ended	Year ended
		30° June, 2024	30" June, 2023	31" Mar, 2024
		ended ended 30" June, 2024 30" June, 2023 3 Unaudited Unaudited 44.59 34.84 Deptional items) 26.26 20.90 Exceptional items) 26.26 20.90 Exceptional items) 19.39 15.64 Tax) and	Audited	
1	Total Income from Operations	44.59	34.84	189.72
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	26.26	20.90	105.03
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	26.26	20.90	105.03
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	19.39	15.64	78.58
5	Total Comprehensive Income for the period [(Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]			
6	Equity Share Capital (of Rs.10/- each)	55.90	42.52	54.98
7	Earnings Per Share of Rs 10/- each (For Continuing Operations- Not Annualised) (In Rs.) 1, Basic 2, Diluted	3.52 3.47	3.77 2.84	15.72 15.31
Notes				d 0

is available on the website of Stock Exchange, www.bseindia.com and on the website of the Company at www.sgfinserve.com For and on behalf of the Board of Directors of SG Finserve Limited

Place : Delhi Sd/- Rahul Gupta Date: July 10, 2024 Director DIN:- 07151792

VIKALP SECURITIES LIMITED

CIN: L68200UP1986PLC007727 (Regd. Office: 25/38 Karachi Khana, Kanpur, Uttar Pradesh, India, 208001)

Tel No. +91 9336810132 | Website: www.vikalpsecurities.com | E-Mail: vikalpsecuritieslimited@gmail.com

Recommendations of the Committee of Independent Directors (IDC) on the Open Offer to the Shareholders of the Vikalp Securities Limited ("Target Company") under Regulation 26(7) of the SEBI (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 and subsequent amendments thereto ("SEBI (SAST) Regulations") in relation to the open offer to the public shareholders of the Target Company ("Open Offer") made by Deepakbhai Patel (Acquirer No. 1), Kamuben Patel, (Acquirer No. 2), and Priyam Shah (PAC) for the acquisition of Equity Shares of the Target Company.

1	Date	July 10, 2024
2	Name of the Target Company	Vikalp Securities Limited
3	Details of the Offer pertaining to Target Company	Open Offer is being made by the Acquirers and PAC for the acquisition of Up To 7,93,500 (SEVE LAKH NINETY THREE THOUSAND FIVE HUNDRED) fully paid-up equity shares of Rs. 10.00/- eac representing 26.00% of the equity and voting share capital at a price of Rs. 25.00/- (Rupees Twen five Only) per equity share, payable in cash in terms of regulation 3(1) & 4 of the SEBI (SAS Regulations,2011.
4	Name(s) of the Acquirers and PAC with the acquirer	Deepakbhai Patel, (Acquirer No. 1), Kamuben Patel, (Acquirer No. 2), Priyam Shah, (PAC)
5	Name of the Manager to the Offer	INTERACTIVE FINANCIAL SERVICES LIMITED Address: Office No. 508, Fifth Floor, Priviera, Nehru Nagar, Manekbag, Ahmedabad - 380015, Gujarat, India. Tel No.: +079 49088019; Web Site: www.ifinservices.in; Email: mbd@ifinservices.in; Contact Person: Ms. Jaini Jain; SEBI Reg No: INM000012856
6	Members of the Committee of Independent Directors ("IDC")	Mr. Vinod Kumar Sharma (Chairman), Mr. Sharad Tandon (Member) and Mr. Shobhit Tiwa (Member)
7	IDC Member's relationship with the Target Company (Director, Equity shares owned, any other contract / relationship), if any	As on date none of the Members of the IDC hold any equity shares in the Target Company nor ha any relationship with the other Directors of the Target Company and apart from being the directors the TC they are not related to each other in any manner.
8	Trading in the Equity shares/other securities of the Target Company by IDC Members	Mr. Sharad Tandon has Gifted his entire holding of 1300 Equity shares in the Target Company to his son, on May 27, 2024, during the period from the date of the PA and till the date of the recommendation. None of the members of the IDC have traded in any of the equity shares/ securities of the Targ Company during 12 months period preceding the date of the PA.
9	IDC Member's relationship with the acquirers (Director, Equity shares owned, any other contract / relationship), if any.	None of the IDC Members have any relationship with the Acquirers and PAC.
10	Trading in the Equity shares/other securities of the acquirers by IDC Members	Not Applicable
11	Recommendation on the Open offer, as to whether the offer, is fair and reasonable	The IDC is of the opinion that the Offer Price of Rs. 25.00/- per equity share offered by the Acquire vide Letter of Offer dated July 05, 2024 Shareholders should independently evaluate the offer, mark performance of the Equity Shares of the TC and take informed decisions.
12	Summary of reasons for recommendation	IDC has perused the Letter of Offer dated July 05, 2024, Draft Letter of Offer dated April 30, 202 Detailed Public Statement dated April 23, 2024 and PA issued by Interactive Financial Servic Limited (as Manger to the Open offer) on behalf of Acquirers and PAC on April 15, 2024, the II members have considered the following recommendation:
		 a) Offer price is justified in terms of the parameter prescribed under Regulation 8(1) & 8(2) of t SEBI(SAST) Regulations, 2011.
		b) Keeping in the view the above fact, the IDC members are of the opinion that the offer price of F 25.00/- per equity shares payable in cash to the public shareholders of the Target company fair and reasonable
13	Details of Independent Advisors, if any.	Nil
14	Voting Pattern (Assent/Dissent)	The recommendation were unanimously approved by the member of IDC.
15	Any other matter to be highlighted	Nil

and not misleading, whether by omission of any information or otherwise, and includes all the information required to be disclosed by the Target Company under the SEBI (SAST) Regulations.

For and on behalf of **Committee of Independent Directors of Vikalp Securities Limited**

(Vinod Kumar Sharma) **Chairman of IDC**

PULP AND PAPER L

Registered Office: Survey No. 239, Near Morai Railway Crossing, Village Salvay, Via-Vapi, Valsad - 396191, Gujarat, India. Contact person: Chinmay Methiwala, Company Secretary & Compliance Officer

Telephone: +91 260 6635700 | E-mail id: investors@shreeajit.com | Website: www.shreeajit.com Corporate Identity Number: L21010GJ1995PLC025135

This advertisement is for intimation purpose only and not for publication, distribution or release directly or indirectly outside India. This is not an announcement for

the offer document. All capitalized terms used and not defined herein shall have the same meaning assigned to them in the letter of offer dated January 15, 2024 filed with BSE Limited ("BSE"/"Stock Exchange") and the Securities and Exchange Board of India ("SEBI"). FIRST AND FINAL CALL MONEY NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP EQUITY SHARES (ISIN: IN9185C01015) HELD AS ON THE

RECORD DATE I.E., FRIDAY, JULY 05, 2024. In terms of the letter of offer dated January 15, 2024 ("Letter of Offer"), the Company had issued partly paid-up equity shares, on a rights basis, to its existing eligible

shareholders at an issue price of ₹80 each including a share premium of ₹70 per rights equity share, in the ratio of 2 (Two) right equity shares for every 3 (Three) fully paid-up shares held as on the record date i.e. Thursday, January 18, 2024.

In accordance with the terms of the issue as mentioned in the Letter of Offer, the Company had received ₹48 (comprising ₹6 towards face value and ₹42 towards share premium) per partly paid-up equity share as application money and the partly paid-up equity shares were allotted on Monday, February 26, 2024. The balance amount of ₹32 per partly paid-up equity share (comprising ₹4 towards face value and ₹28 towards share premium) was payable on first and final call (the "First and

The Board of Directors of the Company ("Board") has, at its meeting held on Thursday, June 27, 2024, decided to make the First and Final Call of ₹32 in respect of 35,71,133 outstanding partly paid-up equity shares of face value ₹10 each, issued by the Company, on a rights basis, pursuant to the Letter of Offer.

The Board has fixed Friday, July 05, 2024 as the record date ("Record Date") for the purpose of determining the holders of partly paid-up equity shares to whom the

notice of the First and Final Call (the "First and Final Call Notice"), will be sent. The Company has intimated the Record Date to the Stock Exchange on June 27, 2024. Accordingly, in terms of provisions Companies Act, 2013 ("Act") read with relevant rule made thereunder and the Letter of Offer, the First and Final Call Notice has been sent in electronic mode to the holder of partly paid up equity shares whose e-mail addresses are registered with Company or its Registrar and Transfer Agent ("RTA") or Depository Participant ("DP") as on the Record Date i.e. Friday, July 05, 2024. Further physical copy of First and Final Call Notice along with detailed instructions and Payment slip, has been dispatched through permitted modes at the registered address of those shareholders: a, who has not registered their e-mail address with the Company or its RTA or Depository Participant(s); or b. who has specifically registered their request for the hard copy of the same. The Company has completed the dispatch of the First and Final Call Notice on Wednesday, July 10, 2024. The specimen copy of the First and Final Call Notice is also available on website of the Company at www.shreeajit.com.

Details of First and Final Call Amount Duo # 32 per partly paid up equity share held by shareholders as on the Record Date

Amount oue	X 32 per partry pard-up equity share nero by s	nateriologis as on the necord date	Control of the Contro			
Call Payment Period	From	To	Duration			
can rayment renou	Monday, July 15, 2024	Monday, July 29, 2024	Branch of SCSBs ⁽¹⁾ whenever offered by brokers I Money – Escrow Collection – R A/C			
*	(a) Online ASBA	Through the website of the SCSBs ⁽¹⁾	Section of the program of the section of the sectio			
	(b) Physical ASBA By submitting physical application to the Designated Branch of SCSBs ⁽¹⁾	ed Branch of SCSBs ⁽¹⁾				
and the second	(c) Online	Using the 3-in-1 online trading-demat-bank account whenever offered by brokers				
Modes of Payment	(d) Cheque / Demand raft (made payable to)	Shree Ajit Pulp and Paper Ltd - First and Final C (for resident shareholders) Shree Ajit Pulp and Paper Ltd - First and Final C (for non-resident shareholders)	ACTION OF THE PARTY OF THE PART			

(*Please visit https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpi=yes&intmld=34 to refer to the list of existing SCSBs [Self-Certified]

In accordance with the SEBI circular no. SEBI/HO/CFD/DIL1/CIR/238/2020 dated December 8, 2020, shareholders can also make the First and Final Call Money payment by using the facility of linked online trading-demat-bank account [3-in-1 type accounts], provided by some of the brokers. Shareholders must log into their demat account and under the relevant section proceed with the payment for First and Final Call Money of Shree Ajit Pulp and Paper Limited. Shareholders are requested to check with their respective brokers for exact process to be followed. Shareholders may please note that this payment method can be used only if the concerned broker has made this facility available to their customer. The Company, Lead Manager or Registrar will not be responsible for non-availability of this payment method to the shareholders.

In the case shareholders choose to pay through Cheque / DD, the payment slip (stating Full Name of the Sole/First shareholder; First and Final Call Notice No.; DP ID-Client ID/Folio No.; and No. of partly paid-up equity shares.) along with the amount payable by cheque or demand draft must be presented at Axis Bank Limited at the following locations on or before Monday, July 29, 2024:

For Resident Shareholders	Ahmedabad: Trishul-Opposite Samartheshwar Temple, Ahmedabad - 380006, Gujarat; Mumbai: Jeevan Prakash Building, Ground Floor, Sir P M Road, Fort, Mumbai - 400001, Maharashtra; Kolkata: 7, Shakespeare Sarani, Kolkata - 700071, West Bengal; Chennai: 82, Dr. Radhakrishnan Salai Mylapore, Chennai - 600004, Tamil Nadu; Delhi: Statesman House, 148, Barakhamba Road, New Delhi: 110001, Delhi; Hyderabad: 6-3-879/B, First Floor, G Pulla Reddy, BL Greenlands, Begumpet Road, Hyderabad - 500016, Telangana; Bangalore: No.9, M.G. Road, Block A, Bengaluru - 560001, Karnataka; Jaipur: 0-15, Green House, Ashok Marg, C-Scheme, Jaipur - 302001, Rajasthan; Vadodara: Vardhaman Complex, Opp. G.E.B, Race Course Circle (North), Vadodara - 390007, Gujarat; Noida: B2-B3, Sector 16, Noida - 201301, Uttar Pradesh; Panvel: Raje Complex, Plot No 198A, Shivaji Chowk, Panvel - 410206, Maharashtra; Pune: Indra Pushti, Opposite Fergusson College, Gate No 2, Pune - 411004, Maharashtra; Chandigarh: SCO 343-344, Sector 35-B, Chandigarh - 160022, Chandigarh; Indore: Kamal Palace, 1 Yeshwant Colony, Yeshwant Niwas Road, Indore - 452003, Madhya Pradesh; Surat: Digyijay Towers, Opp. St Xaviers School, GhodDod Road Surat - 395001, Gujarat; Nagpur: M. G. House, Rabindranath Tagore Road, Besides Board Office, Civil Lines, Nagpur - 440001, Maharashtra; Lucknow: 31/93, Ground Floor, I & II Floor, Lucknow - 226001, Uttar Pradesh; Gurgaon: SCO-29, Sector-14, Near Huda Office, Old Delhi-Gurgaon Road, Gurgaon - 122001, Haryana; Thane: Dhiraj Baug, (Near Hari Niwas Circle) LBS Marg, Thane (West), Thane - 400602, Maharashtra; Vashi: Vardhaman Chambers Co-Op-So, Plot No. 84, Sector 17, Vashi, Navi Mumbai - 400705, Maharashtra; Rajkot: Titan, Near K K V Circle, Kalawad Road, Rajkot - 360005, Gujarat; Kanpur: 16/104 A, Civil Lines, Infront Of ICAI Bhawan, Kanpur - 208001, Uttar Pradesh; Jamnagar: Jaidev Arcade, Ground Floor, Park City Main Road, Nr. Joggers Park, Jamnagar - 361008, Gujarat; Faridabad: Shop No6, Crown Complex, Neighbourhood No.2, 1-2 Chowk, N.I.T.,
For Non-Resident Shareholders	Delhi: Statesman House, 148, Barakhamba Road, New Delhi – 110001, Delhi; Mumbai: Jeevan Prakash Building, Ground Floor, Sir P M Road, Fort, Mumbai – 400001, Maharashtra.

Shareholders residing at locations where the ASBA facility or Bank's collection centres are not available, may send their First and Final Call Money along with the completed payment slip by registered post/speed post at the office of the Registrar: Link Intime India Private Limited, C 101, 1st Floor, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai - 400083, Maharashtra, India. Tel No.: +91 810 811 4949, stating the requisite details along with Cheque/Demand Draft payable at Mumbai, such that the same are received on or before the last date of payment of the First and Final Call Money i.e. Monday, July 29, 2024. Shareholders are required to make payment of the First and Final Call Money on or before Monday, July 29, 2024. Please note that, failure to pay the First and Final

Call Money, as aforesaid shall render the partly paid-up equity shares of the Company held by them, including the amount already paid thereon, liable to be forfeited in accordance with the provisions of the Companies Act, 2013 ("the Act"), the Articles of Association of the Company and the Letter of Offer. The trading in ISIN- IN9185C01015 representing partly paid-up equity shares of face value ₹10 each (₹6 paid-up) has been suspended by the Stock Exchange

- effective from Friday, July 05, 2024. Further the ISIN-IN9185C01015 representing partly paid-up equity shares has been suspended by National Securities Depository. Limited (NSDL) and Central Depository Services (India) Limited (CDSL).
- ii. The process of corporate action for converting the partly paid-up equity shares to the fully paid-up equity shares under the present ISIN-INE185C01017 for the existing fully paid-up equity shares, allotted by the depositories, is estimated to be completed within two to three weeks from the last date of payment of the First and Final Call Money stipulated under this Notice. iii. Upon completion of the corporate action, the partly paid-up equity shares shall be converted into fully paid-up equity shares and would be credited to
- iv. In case of non-receipt of the First and Final Call Notice, shareholders can request by e-mail or letter, for the duplicate First and Final Call Notice to the Registrar
- or may also download the same from the Company's website: www.shreeajit.com or the Registrar's website: www.linkintime.co.in. In such a case, however, the shareholder need to fill the DP ID-Client ID, number of partly paid-up equity shares held and amount payable towards the First and Final Call Money.
- v. The shareholder must mention in the Application, his/her PAN number allotted under the Income Tax Act, 1961. All correspondence in this regard may be addressed to:

Date: July 10, 2024

Place: Vapi

Link Intime India Private Limited

ISIN-INE185C01017, allotted by depositories.

LINK Intime C 101, 1st Floor, 247 Park, LBS Marg,

Vikhroli (West), Mumbai - 400083, Maharashtra, India. Telephone: +91 810 811 4949

Email: sappl.callmoney@linkintime.co.in | Website: www.linkintime.co.in Investor Grievance Email: sappl.callmoney@linkintime.co.in

Contact Person: Sumeet Deshpande SEBI Registration Number: INR000004058

For SHREE AJIT PULP AND PAPER LIMITED

Chinmay Methiwala Company Secretary & Compliance Officer

financialexp.epapr.in

एमको इंडिया लिमिटेड

CIN: L74899DL1987PLC029035

पंजीकृत कार्यालय : 10795, शींप नं. जीएफ-7, झंडेवालान रोड,

रेक्सीन बाजार, नबी करीम, नई दिल्ली-110055

कॉर्पोरेट कार्यालय : सी 53-54, सैक्टर-57, नोएडा, उत्तर प्रदेश-201301

फोन (पंजी: कार्यालय) 011- 23636320; (कॉपोरेट कार्यालय) 0120-4601500

ई-मेल : amco.india@ymail.com, वेबसाइट : www.amcoindialimited.com

ई--मेल पते एवं बैंक खाता विवरण पंजीकरण कराने हेतु सदस्यों के लिए सुचना

भारत सरकार द्वारा की गई हरित-अपनाएं पहल और सदस्यों के हितों को ध्यान में रखते हुए कमानी अपने सभी

सदस्यों से अनुरोध करती है कि वे कम्पनी के रिकार्ड में अपने ई-मेल पते एवं बैंक खाता विवरणों को अपडेट

कराएं जिससे उन्हें कम्पनी द्वारा मेजे गए समी संवाद समय पर मिल जाएं और कम्पनी द्वारा समय-समय पर

इसलिए, सदस्यगण जिन्होंने अपना ई-मेल पता पंजीकृत नहीं कराया है या अपना बैंक खाता विवरण अपवेट

नहीं कराया है, उनसे अनुरोध है कि वे इसे रजिस्ट्रान एवं होयर ट्रांसफर एजेंट (आस्टीए) बीटल फाइनेशियल

बीटल फाइनेशियल एंड कम्प्यूटर सर्विसेज प्राइवेट लिमिटेड, बीटल डाउस, तीसरा

कृपया अपने ढीपी से सम्पर्क करें और आपके ढीपी द्वारा सुझाई गई प्रक्रिया के

अनुसार अपना ई-मेल पता, वैंक खाता विवरण एवं मोबाइल नेम्बर पंजीकृत कराएं।

कृते एमको इंडिया लिमिटेड

हस्ता/-

राजीव गुप्ता

प्रबंध निर्देशक

एंड कम्प्यूटर सर्विसेज प्राइवेट लिमिटेड या डिपॉजिटरी प्रतिमागी (डीपी) के पास पंजीकृत कराएं।

त्तल, 99, मदनगीर, एलएससी के पीछे, नई दिल्ली-110062

फोन : 011-29961281-283, 26051061, 26051064

फिजिकल होल्डिंग कम्पनी के रजिस्ट्रार एड शेयर ट्रांसफर एजेंट (आरटीए) को अनुरोध मेजें:

ई-मेल : investor@beetalfinancial.com

घोषित लाभाश सीधे उनके बैंक खातों में पहुंच जाएं।

डिमेट होत्खिंग

स्थान : नोएडा, यूपी

दिनांक : 10.07.2024

आवास फाइनेंसियर्स लिमिटेड A A GY as (पूर्व में "ए यु हाउसिंग फायनेंस लिमिटेड" के नाम से ज्ञात) (CIN: L65922RJ2011PLC034297)

पंजीकृत एवं निगमित कार्याः: 201-202, द्वितीय मंजिल, साउथ एंड स्ववायर, मानसरोवर इंडस्ट्रीयल एरिया, जयपुर-302020 सिक्यरिटाईजेशन अधिनियम २००२ की धारा १३ (२) के अन्तर्गत मांग सुचना पत्र

कम्पनी के प्रधिकृत अधिकारी द्वारा निम्न सुधी के अनुसार ऋणी का खाता एन.पी.ए. होने के कारण निम्न तालिका के अनुसार "विनीय आस्तियों का प्रतिभूमिकरण एव पुनर्गठन और प्रतिभृतिहित प्रवर्तन अधिनियम 2002 ^{??}की घारा 13(2)के अन्तर्गत 60 दिन का नोटिस दिया गया था । नोटिस के अनुसार यदि ऋणी ⁄ गारण्टर 60 दिवस के अंदर बकाया ऋण राशी जमा नहीं कराते हैं तो ऋण की वसुली कंबक सम्पत्ति को नीलाम करके की जायेगी । डिमाण्ड नोटिस की तामील ना होने के कारण नोटिस की छायाप्रति बंधक सम्पत्ति पर चस्पा की जा खुकी है। अत: आपको यह सुचित किया जाता है कि नोटिस प्रकाशित दिनांक से 60 दिन के अन्दर-अन्दर निप्त तालिका के अनुसार रुपया तथा भविष्य का व्याजें, वसुली में होने वाला खर्जा जेमा कराये अन्यशा एक्ट की धारा 13(4) एवं 14 के प्रावधानों के अन्तर्गत निम्न सुचि के अनुसार साम्पिक बंधक सम्पन्ति का भौतिक कब्जा लेने एवं इसे नीलापी कर ऋण राशि की वसली कराने के लिए प्राधिकत अधिकारी स्वतंत्र होंगे ।

ऋणी का नाम	घारा 13(2) के अन्तर्गत नोटिस की दिनांक व राशि	
ओम प्रकाश, विनीत उपाध्याय, माहंश्वरी खाता सं. LNPYJ02220-210158635	08 जुलाई 2024 ₹ 2063205/- 04 जुलाई 2024	सम्पत्ति स्थित : डीपीएस इलाबाद के पास, अराजी नं. 190 का भाग, मौजा-काजीपुर अरेल, परगना व तहसील-करछना, जिला-प्रयागराज, उत्तरप्रदेश क्षेत्रफल 74.67 वर्ग मीटर
सोनी देवी, उमेश कुमार खाता सं. LNPY/18023-240310124	08 जुलाई 2024 र 877407/- 04 जुलाई 2024	मकान नं. 1कं/14बी/2आर, मोहल्ला ओमप्रकाश सभासद नगर कालिंदीपुरम, परगना व तहसील-सदर, जिला-इलाहाबाद/ प्रयागराज पिन-211011, उत्तरप्रदेश क्षेत्रफल 38.22 वर्ग मीटर
स्थान : जयपुर दिनांक 11.	07.2024	प्राधिकृत अधिकारी आवास फाइनेंसियर्स लिमिटेड

पवीन्ह १०:०० वर्ज से उपलब्ध है।

उ०प्र० राज्य सेतु निगम लिमिटेड

विभृति खण्ड, गोमती नगर, लखनऊ-226010

Email- gmlkoupsbc@gmail.com

ई-निविदा संधः 357/E-TenderiCPM LKO/2024-25 दिनांजः 10.07.2024

ई-टेण्डरिंग गिविदा सुचना

नुबंधर लखनऊ में लखनऊ-युक्ताबपुर मार्ग के किमी०-10 में मरी माता मूदिर रिवत संकरे लघु सेंचु के खान पर 5%

6.00×6.00 मी० स्पान एवं 1×6.ठॅ०×6.08 मी० स्पान के

आर०सी०सी० वाक्स करवर्ट, पहुँच मार्ग एवं अतिरिक्त पहुँच मार्ग के डिजाइन एवं निर्माण कार्व हेतु ई०प्री०सी० मोड पर

ई-निविदा आमोत्रेत की गयी है, जिसकी पूर्ण विवरण वेबसाइड

http://etender.up.nic.in पर दिनांक । 1.07.2024 की

मुख्य परियोजना प्रबन्धक (लखनऊ)

कार्यालय मुख्य परियोजना प्रबन्धक (लखनऊ)

Regd. Office: A-1, UPSIDC Indl. Area, Nandgaon Road, Kosi Kalan, Distt. Mathura (U.P.)-281403

S.	Particulare	Particulars Standalone			Consolidated				
No.	raticulats	(Quarter ende	d	Year ended	Quarter ended			Year ended
1928)		30.06.2024 Unaudited	31.03.2024 Audited	30.06.2023 Unaudited	31.03.2024 Audited	30.06.2024 Unaudited	31.03.2024 Audited	30.06.2023 Unaudited	31.03.2024 Audited 13,323.64 11,753.84 9,228.70 158,146.80 1,104.91 382,101.68
1. 2. 3. 4.	Total income from operations Net profit/(loss) before tax Net profit/(loss) after tax Total comprehensive income for the period/year [Comprising	(87.89) (66.85)	(112.59) (85.08)	(63.36) (46.50)	2.27 (346.62) (259.29)	(445.52) (187.28)	(362.92) (571.01) (147.33)	9,274.05 8,299.14 6,281.21	11,753.84
5.	profit/(loss) (after tax)and other comprehensive income (after tax)} Equity share capital Other equity Earnings per share (of ₹ 2/- each)(*not annualised)	55,893.14 1,104.91	23,354.91 1,104.91	24,500.29 1,104.91	96,516.06 1,104.91 290,141.60	72,269.46 1,104.91	39,063.37 1,104.91	36,058.42 1,104.91	1,104.91
te:	(1) Basic (₹) (2) Diluted (₹)	(0.12)* (0.12)*	(0.15)* (0.15)*	(0.08)* (0.08)*	(0.47) (0.47)	(0.34)* (0.34)*	(0.27)* (0.27)*	11.37* 11.37*	16.70 16.70

under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated results for the quarter ended on 30th June 2024 are available on the websites of the Stock Exchanges (www.nseindia.com/ www.bseindia.com) and on the Company's website (www.hexatradex.com)

On behalf of Board For Hexa Tradex Limited Dr. Raj Kamal Aggarwal Chairperson DIN: 00005349

वैभव ग्लोबल लिमिटेड पंजीकृत कार्यालय- के-6बी, फतेह टीबा, आदर्श नगर, जयपर-302004

फोन : 91-141-2601020; CIN : L36911RJ1989PLC004945 ई-मेल : investor relations@vaibhavglobal.com; वेबसाइट : www.vaibhavglobal.com

35 वीं वार्षिक साधारण सभा (एजीएम) की सूचना

सुचित किया जाता है कि वैभव ग्लोबल लिमिटेड के सदस्यों की 35 वीं वार्षिक साधारण सभा (एजीएम) गुरुवार, 1 अगस्त, 2024 को सार्थ 4 बजे, धारतीय मानक समय (आईएसटी) वीडियो कांफ्रोंसिंग (वीसी) व अन्य ऑडियों विज्ञाल माध्यम (ओएवीएम) के जरिए मीटिंग के नोटिस में शामिल प्रस्तावों का क्रियान्वयन हेतु आयोजित की जाएगी, जो कि मिनिस्टी ऑफ कॉर्पोरेट अफेयर्स (एमसीए) द्वारा जारी सामान्य सर्कुलर नंबर 09/2023 दिनाँकित 25 सितम्बर 2023 एवं भारतीय प्रतिभृति एवं विनिमय बोर्ड (संबी)(सम्मिलित रूप से जारी किए गए सर्कुलर्स) द्वारा जारी सर्कुलर क्रमांक SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 दिनांकित 07 अक्टूबर, 2023 जो कि कम्पनियों को वीसी/ओएवीएम के माध्यम से एजीएम आयोजित करने की अनुमति देता है ।

उक्त सर्व्हलरों व लागू कानूनों की अनुपालना के तहत 35 वीं वार्षिक साधारण सभा की सूचना व वित्त वर्ष 2023-24 की वार्षिक रिपोर्ट उन सभी सदस्यों को इलेक्ट्रोनिक माध्यम से बुधवार, 10 जुलाई 2024 को भेज दी गयी है, जिनके ई-मेल आईडी कंपनी/ डिपॉजिटरी पार्टिसिपेंट/ रजिस्ट्रार व शेवर ट्रांसफर एजेंसी (आस्टीए) के साथ पंजीकृत हैं । उपरांक्त सूचना कंपनी की वेबसाइट www.vaibhavglobal.com, स्टॉक एक्सचेंजों की वंबसाइट www.bseindia.com व www.nseindia.com, कम्पनी के आरटीए केफिन टेक्नोलॉजी लिमिटेड(केफिनटेक)की वेबसाइट www.evoting.kfintech.com पर भी उपलब्ध है।

कंपनी अधिनियम, 2013 की धारा 108 और कंपनी नियम, 2014 (प्रबंधन और प्रशासन) के नियम 20 के प्रावधानों के अनुसार, समय-समय पर संशोधित किए गए और लिस्टिंग विनियमों के विनियमन 44 के प्रावधानों के अनुसार सदस्यों को 35 वीं एजीएम की सूचना में सभी प्रस्तावों पर केफिनटेक द्वारा प्रदान की गई दुरस्थ ई-बोटिंग संवाओं के माध्यम से इलेक्टोनिक माध्यम से अपना बोट डालने की सविधा प्रदान की जाती है। निदेशक मण्डल ने निष्पक्ष और पारदर्शी तरीके से मतदान के लिए भी बी के शर्मा, प्रैक्टिसिंग कंपनी सचिव को स्कूटनाईजर नियक्त किया है।

इस संदर्भ में सदस्यों को यहां सचित किया जाता है कि :

- सदस्य केवल वीसी/ओएवीएम सुविधा के माध्यम से एजीएम में शामिल हो सकते हैं और भाग ले
- बी- रिमोट ई-बोटिंग पोर्टल या सुविधा रविवार, 28 जुलाई, 2024 को सुबह 10:00 वर्ज से बुधवार, 31 जलाई 2024 की शाम 5 बजे (भारतीय समयानसार) तक खली रहेगी। उपरोक्त निर्धारित समयावधि के पञ्चात् रिमोट ई- वोटिंग की सविधा उपलब्ध नहीं रहेगी।
- सी- जिन व्यक्तियों के नाम गुरूवार 25 जुलाई, 2024 (कट-ऑफ तिथि) को कंपनी के सदस्य के रूप में पंजीकृत हैं या रजिस्टर में दर्ज हैं, उन्हें ही रिमोर्ट ई-बोटिंग अथवा एजीएम के जरिये मतदान का
- डी- जो व्यक्ति एजीएम की सूचना भेजे जाने के उपरान्त सदस्य बने हैं तथा कट-ऑफ तिथि यानि गुरूवार 25 जुलाई, 2024 को कंपनी के शेयर बारण करते हैं वे अपना यूजर आईडी एवं पासवर्ड evoting@kfintech.com पर इंमेल कर के प्राप्त कर सकते हैं। युजर आईडी व पासवर्ड प्राप्त करने की विस्तृत जानकारी एजीएम की सुचना में भी उपलब्ध है।
- जिन सदस्यों ने रिमोट ई-बोटिंग के जरिये अपना मतदान किया हैं, वे एजीएम में वीडियो कांफ्रॉसिंग (वीसी) व अन्य ऑडियो विजञ्जल माध्यम (ओएबीएम) के जरिये उपस्थित हो सकते हैं, लेकिन उन्हें फिर से मतदान का अधिकार नहीं रहेगा। जिन सदस्यों के पास वोटिंग का अधिकार है, लेकिन उन्होंने रिमोर्ट ई-वोटिंग के द्वारा मताधिकार का उपयोग नहीं किया है, वे एजीएम में अपने मताधिकार का
- एफ- उक्त संदर्भ में कोई जानकारी हासिल करनी हो या समस्या हो तो निम्नॉकित पर्त पर संपर्क किया जा सकता है : श्रीमती सी शोभा आनंद, डीप्टी बाइस प्रेसिडेंट, क्रेफिन टेक्नोलॉजी लिमिटेड, सेलेनियम टावर, बी, भूखण्ड संख्या 31-32, गचिबांली, फाईनेंशियल डिस्ट्क्ट, नानकरामगुडा, हैदराबाद-500032, टोल फ्री नम्बर: 1800-349-4001, ई-मेल: evoting@kfintech.com

कते वैभव ग्लोबल लिमिटेड

स्थान : जयप्र दिनांक : 10 जुलाई, 2024

वह सुचना अंग्रेजी प्रारूप का रूपांतरण है।

स्शील शर्मा कंपनी सचिव एफसीएस-6535

कब्जा-सूचना

लिमिटेड के रूप में विदित) के प्राधिकृत अधिकारी के रूप में वित्तीय परिसम्पत्तियों के प्रतिभृतिकरण एवं पुनर्निर्माण तथा प्रतिभूति हित प्रवर्तन अधिनियम २००२ के अंतर्गत और प्रतिभूति हित (प्रवर्तन) नियमावली 2002 के नियम 3 के साथ पठित धारा 13(2) के अंतर्गत प्रदत्त शक्तियों के प्रयोगांतर्गत ऋणकर्ता(ओं) / सह—ऋणकर्ता(ओं) को मांग सूचनायें निर्गत की थीं, जिनमें ऋणकर्ताओं को उक्त सूचनाओं की प्राप्ति की तिथि से 60 दिनो के अंदर उक्त सूचनाओं में निम्न तालिका में वर्णित संबंधित नामों के समक्ष अंकितानुसार राशि का राशि पर प्रयोज्य दरों पर आकलित ब्याज और भुगतान तथा / अथवा वसूलीकरण की तिथि तक उपगत प्रयोज्यानुसार भावी ब्याज, आकस्मिक व्ययों, लागतों, शुल्कों, इत्यादि का प्रतिभुगतान करने को कहा गया था।

क्रं सं.	ऋण संख्या	ऋणकर्ता / सह—ऋणकर्ता / गारंटर / बंधककर्ता	13(2)नोटिस दिनांक / निम्न के अनुसार बकाया देय (रु. में)	दिनांक / समय एवं कब्ज़ा का प्रकार
1.	47919430000722	1) श्री अरुण कुमार, पुत्र श्री वीरेंद्र कुमार (आवेदक), 2) श्रीमती रितु शर्मा,पत्नी श्री अरुण कुमार (सह—आवेदक)	15.03.2024 दिनांक 12.03.2024 तक रु.18,82,078 / — (अठारह लाख बयासी हजार अठहत्तर मात्र)	दिनांक— 09.07.2024 समय— अपराह्न 04:53 बजे, प्रतीकात्मक कब्ज़ा

प्रतिभूति संपत्ति का विवरणः अचल संपत्ति 5/59 ,खेवट संख्या 399/1 का हिस्सा, खतौनी 446, खसरा संख्या 100 / / 15 / 4(2–19), बक्तर 00–05 मरले, वाका मौजा डेरा संख्या 190, तहसील नारायणगढ़, जिला अंबाला वाली सम्पत्ति का वह सम्पूर्ण टुकड़ा और अंश । स्वामित्व श्रीमती रितु शर्मा, पत्नी श्री अरुण कुमार के पास है । सीमाः पूर्वः साइड 27 फीट दूसरे का घर, पश्चिमः गली 27 फीट, उत्तरः साइड 50 फीट दूसरे का घर, दक्षिणः साइड 50 फीट दूसरे का प्लॉट।

47919420000044	1) श्री इश्लाम,	27.03.2024	दिनांक—
	पुत्र नाजिरू	दिनांक 26.03.2024 तक	09.07.2024
	(आवेदक),	रु.11,67,363 / —(ग्यारह	समय-अपराह
	2) श्रीमती पाकीजा,	लाख सड़सट हजार तीन	03:58 बजे,
	पत्नी इस्लाम	सौ तिरसठ रूपए मात्र)	प्रतीकात्मक
	·	. ,	कल्प

प्रतिभूति संपत्ति का विवरणः तहसील बिलासपुर जिला यमुनानगर में स्थित खेवट खतौनी नंबर 50 / 80 और 84, खसरा नंबर 26 / / 10 / 2 / 2, 10 / 3,25 / / 5 / 2 / 2, 26 / / 10 / 4, 11 / 4 25 / / 5 / 3 / 2, 26 / / 11 / 1, 11 / 3, 26 / / 11 / 2 कित्ते 9 रकबा ताड़ी 13 कनाल 13 मरले पार्ट बक्दार 21/546, 10.5 मरले बाका रकबा मीजा मियापुर एच.बी नंबर 51 वाली अचल संपत्ति का वह सम्पूर्ण टुकड़ा एवं अंश जिसमें जमाबंदी वर्ष 2017-2018 के लिए है। इसका स्वामित्व श्री इशलाम पुत्र नजीरू के पास है। सीमाः पूर्वः अमरजीत की संपत्ति 64 फीट, पश्चिमः संपत्ति

ı	47919420001099	1) श्री सूरज, पुत्र श्री	18.03.2024	दिनांक—
ı	एवं	मलखान (आवेदक),	दिनांक 17.03.2024 तक	09.07.2024
ı	47919420001225	2)श्रीमती लक्ष्मी, पत्नी	रु.7,88,070 ∕ −	समय–
ı		श्री मलखान	(सात लाख अड्डासी हजार	अपराह्न
ı		(सह—आवेदक),	रु. और सत्तर रु. मात्र)	03:23 बजे,
ı		3) श्री कमल, पुत्र श्री		प्रतीकात्मक
ı		मलखान (सह–आवेदक)		कब्ज़ा

प्रतिभूति संपत्ति का विवरणः गांव मलिकपुर, वाका रकबा मौजा बांगर नंबर 268, तहसील बिलासपुर, जिला यमुना नगर, हरियाणा में स्थित अंचल संपत्ति खेवट नंबर 42 मिन, खतौनी नंबर 55, खसरा नंबर 52 / / 26, 5 / 342 रकबा 17 कनाल 2 मरले, बकदार 5 मरले का हिस्सा वाली सम्पत्ति का वह सम्पूर्ण टुकड़ा एवं अंश। इसका स्वामित्व श्री सूरज, पुत्र श्री मलखान के पास है। इसकी सीमाएँ: पूर्वः श्रीमती सविता का प्लॉट 22', पश्चिमः 22–0 स्ट्रीट 15 फीट चौड़ी, उत्तरः श्रीमती रेशमा का प्लॉट 62', दक्षिणः श्रीमती सविता का प्लॉट 66' है।

चूंकि यहां इसमें उपरोक्त वर्णित ऋणकर्ता(ओं) / सह-ऋणकर्ता(ओं) / गारंटरों / बंधककर्तागणों निर्धारित देयराशि का प्रतिभुगतान करने में विफल हो चुके हैं, अतएव एतदृद्वारा यहां इसमें उपरोक्त वर्णित ऋणकर्ताओं को विशेष रूप में तथा जनसाधारण को सामान्य रूप में सूचित किया जाता है कि जना स्मॉल फाइनेंस बैंक लिमिटेड के प्राधिकृत अधिकारी ने यहां इसमें उपरोक्त विवरणित संपत्तियों / प्रतिभूत परिसंपत्तियों का, उक्त नियमावली के नियम 8 के साथ पठित उक्त अधिनियम की धारा 13(4) के अंतर्गत उन्हें प्रदत्त षिक्तयों के प्रयोगान्तर्गत. उपरांकित तिथियों पर प्रतीकात्मक कब्ज़ा कर लिया है। यहां इसमें उपरोक्त वर्णित ऋणकर्ताओं / सह—ऋणकर्ताओं / गारंटरों / बंधककर्ताओं को विषेष रूप में तथा जनसाधारण को एतदद्वारा सामान्य रूप में सावधान किया जाता है कि उपर्युक्त संपत्तियों / प्रतिभूत परिसंपत्तियों का लेन–देन न करें तथा उक्त संपत्तियों / प्रतिभूत परिसंपत्तियों का कोई व किसी भी प्रकार का लेन–देन, जना स्मॉल फाइनेंस बैंक लिमिटेड के प्रभाराधीन होगा।

स्थान : यमुनानगर हस्ता./-प्राधिकृत अधिकारी दिनांक : 11-07-2024 कृते जना स्मॉल फाइनेंस बैंक लिमिटेड

> जना स्मॉल फाइनेंस बैंक (एक अनुसूचित वाणिज्यिक बैंक)

पंजीकृत कार्यालय :— द फेयरवे, भू एवं प्रथम तल, सर्वे नं. 10/1, 11/2 एवं 12/2बी, ऑफ डोम्लुर, कोरमंगला इनर रिंग रोड, ईजीएल बिजनेस पार्क के समीप, छल्लाघट्टा, बैंगलोर–560071, **शाखा** कार्यालय: 16/12, द्वितीय तल, डब्ल्यु.ई.ए., आर्य समाज मार्ग, करोल बाग, नई दिल्ली-110005

SHREE AJIT PULP AND PAPER LIMITED Registered Office: Survey No. 239, Near Morai Railway Crossing, Village Salvay, Via-Vapi, Valsad - 396191, Gujarat, India.

Contact person: Chinmay Methiwala, Company Secretary & Compliance Officer Telephone: +91 260 6635700 | E-mail id: investors@shreeajit.com | Website: www.shreeajit.com Corporate Identity Number: L21010GJ1995PLC025135

This advertisement is for intimation purpose only and not for publication, distribution or release directly or indirectly outside India. This is not an announcement for the offer document. All capitalized terms used and not defined herein shall have the same meaning assigned to them in the letter of offer dated January 15, 2024 filed with BSE Limited ("BSE"/"Stock Exchange") and the Securities and Exchange Board of India ("SEBI").

FIRST AND FINAL CALL MONEY NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP EQUITY SHARES (ISIN: IN9185C01015) HELD AS ON THE RECORD DATE I.E., FRIDAY, JULY 05, 2024.

In terms of the letter of offer dated January 15, 2024 ("Letter of Offer"), the Company had issued partly paid-up equity shares, on a rights basis, to its existing eligible shareholders at an issue price of ₹80 each including a share premium of ₹70 per rights equity share, in the ratio of 2 (Two) right equity shares for every 3 (Three) fully paid-up shares held as on the record date i.e. Thursday, January 18, 2024

In accordance with the terms of the issue as mentioned in the Letter of Offer, the Company had received ₹48 (comprising ₹6 towards face value and ₹42 towards share premium) per partly paid-up equity share as application money and the partly paid-up equity shares were allotted on Monday, February 26, 2024. The balance amount of ₹32 per partly paid-up equity share (comprising ₹4 towards face value and ₹28 towards share premium) was payable on first and final call (the "First and

The Board of Directors of the Company ("Board") has, at its meeting held on Thursday, June 27, 2024, decided to make the First and Final Call of ₹32 in respect of 35,71,133 outstanding partly paid-up equity shares of face value ₹10 each, issued by the Company, on a rights basis, pursuant to the Letter of Offer.

The Board has fixed Friday, July 05, 2024 as the record date ("Record Date") for the purpose of determining the holders of partly paid-up equity shares to whom the notice of the First and Final Call (the "First and Final Call Notice"), will be sent. The Company has intimated the Record Date to the Stock Exchange on June 27, 2024. Accordingly, in terms of provisions Companies Act, 2013 ("Act") read with relevant rule made thereunder and the Letter of Offer, the First and Final Call Notice has been sent in electronic mode to the holder of partly paid up equity shares whose e-mail addresses are registered with Company or its Registrar and Transfer Agent ("RTA") or Depository Participant ("DP") as on the Record Date i.e. Friday, July 05, 2024. Further physical copy of First and Final Call Notice along with detailed instructions and Payment slip, has been dispatched through permitted modes at the registered address of those shareholders: a. who has not registered their e-mail address with the Company or its RTA or Depository Participant(s); or b. who has specifically registered their request for the hard copy of the same. The Company has completed the dispatch of the First and Final Call Notice on Wednesday, July 10, 2024. The specimen copy of the First and Final Call Notice is also available on website of the Company at www.shreeajit.com.

Details of First and Final Call

Amount Due	₹ 32 per partly paid-up equity share held by s	hareholders as on the Record Date	100 0 100 n			
Call Dayment Dayled	From	To	Duration			
Call Payment Period	Monday, July 15, 2024	Monday, July 29, 2024	15 days			
	(a) Online ASBA	Through the website of the SCSBs ⁽¹⁾				
	(b) Physical ASBA	By submitting physical application to the Designated Branch of SCSBs ^[1]				
	(c) Online	Using the 3-in-1 online trading-demat-bank account whenever offered by brokers				
Modes of Payment	(d) Cheque / Demand raft (made payable to)	 a. Shree Ajit Pulp and Paper Ltd - First and Final Ca (for resident shareholders) b. Shree Ajit Pulp and Paper Ltd - First and Final Ca (for non-resident shareholders) 				

Please visit https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognisedFpi=yes&intmld=34 to refer to the list of existing SCSBs [Self-Certified] Syndicate Banks)

In accordance with the SEBI circular no. SEBI/HO/CFD/DIL1/CIR/238/2020 dated December 8, 2020, shareholders can also make the First and Final Call Money payment by using the facility of linked online trading-demat-bank account [3-in-1 type accounts], provided by some of the brokers. Shareholders must log into their demat account and under the relevant section proceed with the payment for First and Final Call Money of Shree Ajit Pulp and Paper Limited. Shareholders are requested to check with their respective brokers for exact process to be followed. Shareholders may please note that this payment method can be used only if the concerned broker has made this facility available to their customer. The Company, Lead Manager or Registrar will not be responsible for non-availability of this payment method

In the case shareholders choose to pay through Cheque / DD, the payment slip (stating Full Name of the Sole/First shareholder; First and Final Call Notice No.; DP ID-Client ID/Folio No.; and No. of partly paid-up equity shares.) along with the amount payable by cheque or demand draft must be presented at Axis Bank Limited at the following locations on or before Monday, July 29, 2024:

For Resident Shareholders

For Non-Resident

Date: July 10, 2024

Place: Vapi

Ahmedabad: Trishul-Opposite Samartheshwar Temple, Ahmedabad - 380006, Gujarat; Mumbai: Jeevan Prakash Building, Ground Floor, Sir P M Road, Fort, Mumbai - 400001, Maharashtra: Kolkata: 7, Shakespeare Sarani, Kolkata - 700071, West Bengal: Chennai: 82. Dr. Radhakrishnan Salai Mylapore, Chennai - 600004, Tamil Nadu; Delhi: Statesman House, 148, Barakhamba Road, New Delhi- 110001 Delhi; Hyderabad: 6-3-879/B, First Floor; G Pulla Reddy, BL Greenlands, Begumpet Road, Hyderabad - 500016, Telangana; Bangalore; No.9, M.G. Road, Block A. Bengaluru - 560001, Karnataka: Jaipur: 0-15, Green House, Ashok Marg, C-Scheme, Jaipur - 302001, Rajasthan; Vadodara; Vardhaman Complex, Opp. G.E.B., Race Course Circle (North), Vadodara - 390007, Gujarat; Noida; B2-B3, Sector 16, Noida - 201301, Uttar Pradesh; Panvel: Raje Complex, Plot No 198A, Shivaji Chowk, Panvel - 410206, Maharashtra; Pune: Indra Pushti, Opposite Fergusson College, Gate No 2, Pune - 411004, Maharashtra; Chandigarh: SCO 343-344, Sector 35-B, Chandigarh -160022, Chandigarh; Indore: Kamal Palace, 1 Yeshwant Colony, Yeshwant Niwas Road, Indore - 452003, Madhya Pradesh; Surat: Digvijay Towers, Opp. St Xaviers School, GhodDod Road Surat - 395001, Gujarat; Nagpur: M. G. House, Rabindranath Tagore Road, Besides Board Office, Civil Lines, Nagpur - 440001, Maharashtra: Lucknow: 31/93, Ground Floor, I & II Floor, Lucknow - 226001, Uttar Pradesh; Gurgaon: SCO-29, Sector-14, Near Huda Office, Old Delhi-Gurgaon Road, Gurgaon - 122001, Harvana: Thane: Dhirai Baug, (Near Hari Niwas Circle) LBS Marg, Thane (West), Thane - 400602, Maharashtra; Vashi: Vardhaman Chambers Co-Op-So, Plot No. 84, Sector 17, Vashi, Navi Mumbai - 400705, Maharashtra; Rajkot: Titan, Near K K V Circle, Kalawad Road, Rajkot - 360005, Gujarat; Kanpur: 16/104 A, Civil Lines, Infront Of ICAI Bhawan, Kanpur - 208001, Uttar Pradesh; Jamnagar: Jaidev Arcade, Ground Floor, Park City Main Road, Nr. Joggers Park, Jamnagar - 361008, Gujarat; Faridabad; Shop No.-6, Crown Complex, Neighbourhood No.2, 1-2 Chowk, N.I.T., Faridabad 121001, Haryana; Gandhinagar: Gandhinagar Milk Consumer Co-Op Union Lt, Plot No. 436, Sector 16, Gandhinagar - 382016, Gujarat. Delhi: Statesman House, 148, Barakhamba Road, New Delhi - 110001, Delhi; Mumbai: Jeevan Prakash Building, Ground Floor, Sir P M

Shareholders Road, Fort, Mumbai - 400001, Maharashtra. Shareholders residing at locations where the ASBA facility or Bank's collection centres are not available, may send their First and Final Call Money along with the completed payment slip by registered post/speed post at the office of the Registrar: Link Intime India Private Limited, C 101, 1st Floor, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai - 400083, Maharashtra, India. Tel No.: +91 810 811 4949, stating the requisite details along with Cheque/Demand Draft payable at Mumbai, such that

Shareholders are required to make payment of the First and Final Call Money on or before Monday, July 29, 2024. Please note that, failure to pay the First and Final Call Money, as aforesaid shall render the partly paid-up equity shares of the Company held by them, including the amount already paid thereon, liable to be forfeited in accordance with the provisions of the Companies Act, 2013 ("the Act"), the Articles of Association of the Company and the Letter of Offer.

effective from Friday, July 05, 2024. Further the ISIN-IN9185C01015 representing partly paid-up equity shares has been suspended by National Securities Depository. Limited (NSDL) and Central Depository Services (India) Limited (CDSL). ii. The process of corporate action for converting the partly paid-up equity shares to the fully paid-up equity shares under the present ISIN-INE185C01017 for the

The trading in ISIN- IN9185C01015 representing partly paid-up equity shares of face value ₹10 each (₹6 paid-up) has been suspended by the Stock Exchange

- existing fully paid-up equity shares, allotted by the depositories, is estimated to be completed within two to three weeks from the last date of payment of the First and Final Call Money stipulated under this Notice. iii. Upon completion of the corporate action, the partly paid-up equity shares shall be converted into fully paid-up equity shares and would be credited to
- ISIN-INE185C01017, allotted by depositories.
- iv. In case of non-receipt of the First and Final Call Notice, shareholders can request by e-mail or letter, for the duplicate First and Final Call Notice to the Registrar or may also download the same from the Company's website: www.shreeajit.com or the Registrar's website: www.linkintime.co.in. In such a case, however, the shareholder need to fill the DP ID-Client ID, number of partly paid-up equity shares held and amount payable towards the First and Final Call Money.
- v. The shareholder must mention in the Application, his/her PAN number allotted under the Income Tax Act, 1961.

the same are received on or before the last date of payment of the First and Final Call Money i.e. Monday, July 29, 2024.

All correspondence in this regard may be addressed to: Link Intime India Private Limited **LINK**Intime

C 101, 1st Floor, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai - 400083, Maharashtra, India.

Telephone: +91 810 811 4949 Email: sappl.callmoney@linkintime.co.in | Website: www.linkintime.co.in Investor Grievance Email: sappl.callmoney@linkintime.co.in

Contact Person: Sumeet Deshpande SEBI Registration Number: INR000004058

For SHREE AJIT PULP AND PAPER LIMITED

Chinmay Methiwala Company Secretary & Compliance Officer

कार्मिक (ख-3) विभाग कम्प्यूटर स्टोर

क्रमांक- प.7 (07)/कार्मिक/ख-3/2024 ई-निविदा सूचना

शासन सचिवालय में कार्य आधार पर कम्प्यूटर मय प्रशिक्षित कार्मिको की सेवायें सेवा प्रदाता के माध्यम से लेने हेतु पंजीकृत आईएसओ प्रमाणित एवं अनुभवी सेवा प्रदाताओं से निर्धारित प्रपत्र में ई निविदा के तहत www.eproc.rajasthan.gov.in पर दर संविदा हेतु निविदा दिनांक 24.07.2024 को दोपहर 12.00 बजे तक आमंत्रित की जाती है। निविदा से सम्बन्धित अन्य सूचनाएं विभागीय वेबसाईट www.dop.rajasthan.gov.in अथवा राज्य लोक उपापन पोर्टल (**http://sppp.raj.nic.in**) पर देखी जा सकती है। निविदा का Unique bid No. (UBN) PER2425SLRC00015 है।

DIPR/C/5607/2024

शासन उप सचिव कार्मिक (ख) विभाग

जयपुर, दिनांकः.

आई एफ सी आई. शिमिटेड

Registered Office: IFCI Tower, 61 Nehru Place New Delhi-110 019 Tel: 011-41732000 E-mail: complianceofficer@ifciltd.com Website: www.ifciltd.com CIN: L74899DL1993GOI053677

आज़ादी का अमृत महोत्सव

हस्ता / –

पैनल में शामिल होने के लिए अनुरोध (आरएफई)

आईएफसीआई लिमिटेड (प्रतिष्ठित सॉफ्टवेयर एजेंसियों / वेंडर्स) पोर्टल विकास, उसके प्रबंधन और देखरेख में सक्षम पक्षकारों से पैनल में शामिल होने के लिए प्रस्ताव आमंत्रित करता है। यह पैनल भारत सरकार की योजनाओं के लिये है, जिन्हें आईएफसीआई द्वारा संचालित किया जा

इच्छक पक्षकार अधिक जानकारी के लिए वस्तओं और सेवाओं की खरीद – निविदाएं टैब के तहत www.ifciltd.com को देखें।

स्थानः नई दिल्ली दिनांकः 10 जुलाई, 2024

विभाग प्रमुख (सूचना प्रौद्यौँगिकी)

भारतीय केटेनर निगम लिमिटेड Container Corporation of India Ltd.

नेविदा जमा करने की तिथि एवं समय | 02,08,2024 को 17:00 बजे तक

ई-निविदा आमंत्रण सूचना

कॉनकॉर निम्नलिखित कार्य के लिए एकल पैकेट प्रणाली में ई-मिविदा आमंत्रित करता है:-नविदा संख्या CONVAREA-HIENG/ICD-SNF/E-78991/2024-25

कार्य का नाम आईसीढी सनधनगर (हैदराबाद) में अतिरिक्त अवसंरचना का विकास रु, 378.64 लाख (जीएसटी सहित) पूर्ण होने की अवधि 12 (बारह) महीने ए. 3,39,400.00 (रूपये तीन लाख उनतालीस हजार चार सी मात्र) नेविचा चरलायेज की लागल (अप्रतिवेय) शिन्य

3840 /- (ई-भुगतान के माध्यम से सभी क नेविदा प्रसरकरण शुलक (अप्रतिदेव) 11.07.2024 (15.00 年分 祖) 祖 01.08.2024 (17.00 年分 日本)

05.08.2024 की 15:00 बजे विलीय योग्यता मानवंज, समान प्रकार के कार्य में अनुमव, आदि के लिए कृपया वेबसाइर www.concorindia.co.in पर उपलब्ध विस्तृत निविदा सूचना देखें, लेकिन पूर्ण निविद एलावेज केवल वेबलाइट <u>www.tenderwizard.com/CCIL</u> से खाउनलोज किये जा राकते हैं हंस निविदा के संबंध में आगे शुद्धिपत्र/परिकिष्ट, यदि कोई होगा, तो उसे कंदल वेबसाइट www.concorindia.co.in, www.tenderwizard.com/CCIL एवं सीपीपी पोर्टल पर प्रकाशित केया जाएगा। इसके लिए समाचारपत्र प्रेश विज्ञापन जारी नहीं किया जाएगा। कार्यकारी निदेशक (परियोजनाए) | फोन नंबर: 011-4122250

क्षे सम्बोत्त रजना को जन्म

प्रधानमंत्री संग्रहालय एवं पुस्तकालय

द हाफ-वेड वाइवसः रिचुअल्स ऑफ कान्क्यूबिनेज इन अर्ली मॉडर्न मारवाड़

> आप सादर आमंत्रित हैं। वक्ताः डॉ. प्रियंका खन्ना जूनियर फेलो, प्रधानमंत्री संग्रहालय एवं पुस्तकालय

दिनांकः 11 जुलाई 2024, गुरूवार; समयः अपराह्न 3:00 बजे संगोष्टी कक्ष

प्रधानमंत्री संग्रहालय एवं पुस्तकालय तीन मृर्ति भवन, नई दिल्ली-110011 सभी का स्वागत है।

अपना नाम जोड़ने के लिए कृपया हमें ईमेल करें: ccs2nmml@gmail.com CBC- 09142/12/0014/2425

धनुका एग्रीटेक लिमिटेड सीआईएनः L24219HR1985PLC122802

पंजीकृत और कॉर्पोरेट कार्यालयः ग्लोबल गेटवे टावर्स, एमजी रोड, गुरु द्रोणाचार्य मेट्टो स्टेशन के पास, गुरुग्राम-122 002, फोन नंबर: 0124-4345000, ईमेलः investors@dhanuka.com , वेबसाइटः www.dhanuka.com

39वीं वार्षिक आम बैठक, रिमोट ई-वोटिंग, बुक क्लोजर और वित्त वर्ष 2023-24 के लिए अंतिम लाभांश के उद्देश्य से रिकॉर्ड तिथि की सूचना वार्षिक आम बैठक

रतदद्वारा सुचित किया जाता है कि कंपनी की 39वीं वार्षिक आम बैटक (एजीएम) शुक्रवार, 2 अगस्त, 2024 को सुबह 11:00 बजे (आईएसटी) वीडियो कॉन्फ्रेंसिंग ("वीसी") के माध्यम से नोटिस में निर्धारित व्यवसायों को पूरा करने के लिए आयोजित की जानी है। इस संबंध में पहले के परिपत्रों(सामूहिक रूप से "सेबी परिपत्र" के रूप में संदर्भित) के साथ पठित सेबी / एचओं / सीएफडी / सीएफडी-पीओडी-2 / पी / सीआईआर / 2023 / 167 दिनांक अक्टूबर, 2023 और सामान्य परिपत्र संख्या 14 / 2020 दिनांक 8 अप्रैल, 2020, 20 / 2020 दिनांक 5 मई, 2020 और नवीनतम 09 / 2023 दिनांक 25 सितंबर, 2023 (सामृहिक रूप से "एमसीए परिपत्र" के रूप में संदर्भित) के अनुसरण में, कंपनियों के सदस्यों की एक सामान्य स्थान पर भौतिक उपस्थिति के बिना, वीसी के माध्यम से एजीएम आयोजित करने की अनुमति है। इसलिए, कंपनी की एजीएम एजीएम की सूचना में निर्धारित व्यवसायों को पूरा करने के लिए वीसी के माध्यम से आयोजित की जा रही है।

परिपत्रों के अनुपालन में, एजीएम की सूचना और एकीकृत वार्षिक रिपोर्ट 2023—24 की इलेक्ट्रॉनिक प्रतियां उन सभी सदस्यों को भेज दी गई हैं, जिनकी ईमेल आईडी कंपनी / डिपॉजिटरी प्रतिभागी(ओं) ("डीपी") के साथ पंजीकृत हैं। ये दस्तावेज कंपनी की वेबसाइट www.dhanuka.com पर, स्टॉक एक्सचेंजों की वेबसाइट जैसे कि बीएसई लिमिटेड 'बीएसई') www.bseindia.com और नेशनल स्टॉक एक्सचेंज ऑफ इंडिया लिमिटेड 'एनएसई') www.nseindia.com पर और नेशनल सिक्योरिटीज डिपॉजिटरी लिमिटेड 'एनएसडीएल) की वेबसाइट www.evoting.nsdl.com पर भी उपलब्ध हैं। ईमेल के माध्यम में एजीएम की सूचना भेजने का काम 10 जुलाई, 2024 को पूरा हो गया है।

रिमोट ई-वोटिंग

कंपनी (प्रबंधन और प्रशासन) नियम, 2014 के नियम 20 के साथ पठित कंपनी अधिनियम,2013 'अधिनियम') की धारा 108 के साथ—साथ समय—समय पर संशोधित ,भारतीय कंपनी सचिव संस्थान द्वारा जारी सामान्य बैठकों पर सचिवीय मानक ('एसएस–2') और सेबी (सूचीबद्धता दायित्व और प्रकटीकरण आवश्यकताएं) विनियम, 2015 के विनियम 44 के अनुपालन में, कंपनी अपने सदस्यों को एजीएम से पहले रिमोट ई—वोटिंग की सुविधा के साथ—साथ एजीएम के दौरान एजीएम में किए जाने वाले व्यवसायों के संबंध में ई–वोटिंग की सुविधा प्रदान कर रही है और इस उद्देश्य के लिए, कंपनी ने इलेक्ट्रॉनिक माध्यम से मतदान की सविधा के लिए एनएसडीएल

रिमोट ई—वोटिंग और ई—वोटिंग के लिए विस्तृत निर्देश एजीएम की सूचना में दिए गए हैं सदस्यों से निम्नलिखित बातों पर ध्यान देने का अनुरोध किया जाता है: र. रिमोट ई—वोटिंग सुविधा निम्नलिखित अवधि के दौरान उपलब्ध होगीः

रिमोट ई—वोटिंग की शुरुआत मंगलवार, 30 जुलाई, 2024 (आईएसटी समयानुसार सुबह 9.00 बजे) **रिमोट ई-वोटिंग की समाप्ति** गुरुवार, 1 अगस्त, 2024 (आईएसटी समयानुसार शाम 5.00 बजे) इसके बाद एनएसडीएल द्वारा रिमोट ई-वोटिंग मॉड्यूल को वोटिंग के लिए अक्षम कर दिया

जाएगा और सदस्यों को उक्त तिथि और समय के बाद इलेक्ट्रॉनिक रूप से वोट करने की अनुमति नहीं दी जाएगी; बी. सदस्यों के वोटिंग अधिकार शुक्रवार, 26 जुलाई, 2024 ('कट—ऑफ डेट') को कंपनी की चुकता इक्विटी शेयर पूंजी में उनके हिस्से के अनुपात में होंगे। बैठक के दौरान ई-वोटिंग

प्रणाली की सुविधा भी उपलब्ध कराई जाएगी और बैठक में भाग लेने वाले सदस्य, जिन्होंने पहले से ही रिमोट ई—वोटिंग द्वारा अपना वोट नहीं डाला है, वे बैठक के दौरान अप अधिकार का प्रयोग कर सकेंगे। वह व्यक्ति जिसका नाम कट-ऑफ तिथि को सदस्यों के रजिस्टर/लाभार्थी स्वामियों के रजिस्टर में दर्ज है, वह केवल एजीएम से पहले रिमोट ई-वोटिंग और एजीएम के दौरान ई-वोटिंग की सुविधा का लाभ उठाने का हकदार होगा; सी. कोई भी व्यक्ति जो कंपनी के शेयर प्राप्त करता है और नोटिस भेजे जाने के बाद कंपनी का सदस्य बनता है और कट–ऑफ तिथि को शेयर रखता है, वह एनएसडीएल की अधिकारी वरिष्ठ प्रबंधक सुश्री पल्लवी म्हात्रे को evoting@nsdl.co.in पर अनुरोध भेजकर या टोल

पासवर्ड प्राप्त कर सकता है। डी. जिन सदस्यों ने बैठक से पहले रिमोट ई–वोटिंग द्वारा अपना वोट दिया है, वे भी इलेक्ट्रॉनिक रूप से बैठक में भाग ले सकते हैं, लेकिन उन्हें दोबारा वोट देने का हक नहीं होगा। डिपॉजिटरी यानी एनएसडीएल और सीडीएसएल के माध्यम से लॉगिन से संबंधित किसी भी तकनीकी समस्या के लिए डीमैट मोड में प्रतिभूतियां रखने वाले व्यक्तिगत शेयरधारकों के

फ्री नंबर 022-4886 7000 पर कॉल करके रिमोट ई-वोटिंग के लिए लॉगिन-आईडी और

	लॉगिन प्रकार	हेल्पडेस्क विवरण
	एनएसडीएल के साथ डीमैट	लॉगिन में किसी भी तकनीकी समस्या का सामना करने वाले सदस्य
		evoting@nsdl.com पर अनुरोध भेजकर या 022–4886 7000 पर
	व्यक्तिगत शेयरधारक	कॉल करके एनएसडीएल हेल्पडेस्क से संपर्क कर सकते हैं
-	सीडीएसएल के साथ डीमैट	लॉगिन में किसी भी तकनीकी समस्या का सामना करने वाले सदस्य
		helpdesk.evoting@cdslindia.com पर अनुरोध भेजकर या टोल
	व्यक्तिगत शेयरधारक	फ्री नंबर 1800 22 55 33 पर संपर्क करके सीडीएसएल हेल्पडेस्क

से संपर्क कर सकते है। अंतिम लाभांश और एजीएम के उद्देश्य के लिए बुक क्लोजर और रिकॉर्ड तिथि

सेबी (सूचीकरण दायित्व और प्रकटीकरण आवश्यकताएं), विनियम 2015 के विनियमन 42 के अनुसार, कंपनी ने 31 मार्च, 2024 को समाप्त वित्तीय वर्ष के लिए अंतिम लाभांश के भुगतान के लिए सदस्यों की पात्रता निर्धारित करने के लिए रिकॉर्ड तिथि के रूप में शुक्रवार, 19 जुलाई, 2024 को निर्धारित किया है। इसके अलावा, कंपनी की 39वीं वार्षिक आम बैठक के उद्देश्य से कंपनी के सदस्यों का रजिस्टर और शेयर ट्रांसफर बुक शनिवार, 20 जुलाई, 2024 से शुक्रवार, 2 अगस्त 2024 (दोनों दिन सम्मिलित) तक बंद रहेगी।

धनुका एग्रीटेक लिमिटेड के लिए

जितिन सदाना कंपनी सचिव और अनुपालन अधिकारी एफसीएस-7612

स्थानः गुरुग्राम दिनांकः 10.07.2024

www.readwhere.com

HEXA TRADEX LIMITED

CIN - L51101UP2010PLC042382 Corp. Office: Jindal Centre, 12, Bhikaiji Cama Place, New Delhi- 110066

	EXTRACT OF UNAUDITED FINAN	CIAL RESUL	TS FOR TH	E QUARTE	R ENDED J	UNE 30, 20	24		
	(₹ Lakhs								
8	Particulars		Stand	falone			Consolidated Quarter ended Quarter ended 06.2024 31.03.2024 30.06.2023 31. audited Audited Unaudited A - (362.92) 9,274.05 13 445.52) (571.01) 8,299.14 11		
0.	ratticulars		Quarter ende	d	Year ended		Quarter ende	d	Year end
		30.06.2024 Unaudited	31.03.2024 Audited	30.06,2023 Unaudited	31.03.2024 Audited	30.06.2024 Unaudited			31.03.20 Audite
CARROLL STORY	Total income from operations Net profit/(loss) before tax Net profit/(loss) after tax Total comprehensive income for the period/year [Comprising	(87.89) (66.85)	(112.59) (85.08)	(63.36) (46.50)	2.27 (346.62) (259.29)	(445.52) (187.28)	(571.01)	8,299.14	13,323 11,753 9,228
* 255 CO	profit/(loss) (after tax)and other comprehensive income (after tax)] Equity share capital Other equity	55,893.14 1,104.91	23,354.91 1,104.91	24,500.29 1,104.91	96,516.06 1,104.91 290,141.60	72,269.46 1,104.91	39,063.37 1,104.91	36,058.42 1,104.91	158,146. 1,104. 382,101.

The above is an extract of the detailed format of Standalone and Consolidated financial results for the quarter ended on 30th June 2024 filed with the Stock Exchanges



Place: New Delhi

Date: July 10, 2024

લોકશાહીમાં ચૂંટણીનું જ્ઞાન અનોખી પહેલ સુરતમાં શિક્ષણ સમિતિની સ્કુલના બાળકોની બાળ સંસદમાં EVMમાં મતદાન કરાવાયું



સંસદની ચુંટણી પુરી થઈ છે અને ફરી સત્તાનું સુકાન દ્રક્ષ્છએ સંભાળ્યા છે ત્યારે વિદ્યાર્થી કાળથી જ બાળકોમાં લોકશાહી પ્રથાના બીજ રોપવાનો પ્રયાસ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં આવેલી જુદી જુદી બે શાળા દ્વારા સ્કુલના બાળકોને લોકશાહીના પાઠ ભણાવવા બાળ સંસદમાં ઈવીએમ સ્ટાઈલથી મતદાન કરાવવામા આવ્યું હતું. આ ઉપરાંત ગૂંટણીનું પરિણામ પણ સ્ક્રીન પર જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાઓમાં બાળકોનું

ભાવિ ઘડાય છે. વયસ્ક વ્યક્તિ કરતા બાળકોની ગ્રહણશક્તિ વધુ હોય છે. શાળામાં મળતા પ્રાથમિક જ્ઞાનથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે ગાળ ડાવા સવાગા ભાગસ વાવ છે. જે તેમને સમાજ પ્રત્યે જવાબદાર અને જાગૃત પણ બનાવે છે. રાજ્ય સરકારની આ આવકારદાયક પહેલી બાળકોમાં લોકશાહીના મૂલ્યોનો વિકાસ થાય છે. તે માટે દર વર્ષે પાલિકાની સ્કૂલમાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવે છે અને તેમને લોકશાહીના પાઠ ભણાવવામાં આવે સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ મહારાજ પ્રાથમિક શાળામાંદર

વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદની ચંટણી યોજવામાં આવી રહી છે. બાળ સંસદની રચના માટે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેવી રીતે સ્થાનિક આવ્યું હતું. જેવી રીતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ચૂંટણીની પ્રક્રિયા હોય તેવી તમામ પ્રક્રિયા આ બાળ સંસદની ચૂંટણીમાં કરવામાં આવી હતી.

-- ----આ શાળામાં લોકશાહી ઢબે શાળા સંસદની ચૂંટણી તથા શાળા મહામંત્રી તથા મંત્રીમંડળની રચના કરવામાં આવી. શાળાની બાલવાટીકાથી ધોરણ-૮ની તમામ વિદ્યાર્થીનીઓ મતદાતા તરીકે અને ૧૦ વિદ્યાર્થીઓ ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ચૂંટણી પ્રક્રિયામાં જુદી જુદી ફરજ નિભાવી હતી. ત્યારબાદ મહામંત્રી ઉપમંત્રી, વ્યવસ્થા મંત્રી, સ્વચ્છતા મંત્રી, સાંસ્કૃતિક મંત્રી, પ્રાર્થના મંત્રી, ઇકો ક્લબ મંત્રી, જેવા વિવિધ મંત્રીઓની શપથવિધિ દ્વારા સંસદનું હુબહુ જ્ઞાન આપ્યું હતું. દેશમાં રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. મહામંત્રી તરીકે રાવળ સંધ્યા મહેશભાઈ, ઉપ મહામંત્રી તરીકે ધારીકર અર્ચના વિકાસરામની બહુમતીથી વરણી થઈ હતી

આ ઉપરાંત મોરાભાગળ ખાતે



પનામા પેટ્રોકેમ લિમીટેડ บดามา ปลุเริ่ม ได้มีได้ร รายสะ มีเดียง เพิ่งส์ - 303, ของเก็มมี เล่ะส้ะ, ห่อต้นจะ ฐาชาตะ - 3€3005. ต้นที่ เพิ่งเล่ะ 3€3005. ปู่างก็, เพลเรนะ, ารดองเก. ปู่างก็, เพลเรนะ, ารดองเก. เข้ายะ เพละผลเคลายรถตะ (IM Ns. 122206J.1982/E005062 Phone: 91-22-4217777, Email: cs@panamapetro.com

ા.. નિચમો. અન્ય બાબતોની સાથે, IEPF ડીમેટ ખાતામાં શેરધારકો દ્વારા સળંગ સાત વર્ષ કે તેથી વધુ સમર

ાળવામાં ાળઘાતા આપલાંકાતાંબા તું પાલંગ કરતા, કંપમાંબ સંભાવા શરકારાંકા વ્યક્રાગત ત્યાં સંધા જે બેમના શેર ઉકત નિયમો હેઠળ IEPF કીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે જવાબદાર છે સોંગ્ય પગલાં લેવ ફંપમીએ તેની વૈપસાદિર www.panamapetro.com પર આવા જેરધારકો એના IEPF કીમેટ ખાતામ ફર કરવાના બાકી શેરોની વિગતો પણ અપલોડ કરી છે. શેરધારકોને બિન-કેલ્ડ ડિવિડન્ડની વિગતો અને IEPF એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે જવાબદાર શેરની વિગતો ચકાસવા માટે panamapetro.com/amount-pending-transfer-to-lepf/ નો સંદર્ભ લેવા વિનંતી કરવામાં

દાવા કરા શકાવ છ. ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવનારા અને જેમના શેર IEPF ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે જવ ાંલી તે વ્યવસાના લેવ સારા બારા કરતાં એમના લેવા દાજ કરીકાર ખાતાના દ્વાના સુર કરવા માટે જાલાલા હતે તેવાં હોંધાનિ સ્થાપની મોના કહેલા કે છે કર્યા ખેતી રાખા કરવાના હતું માટે ખાતાના કહ્યું હતું કરતાં હતું કરતાં કહ્યું હતું કરતાં હતું કરતાં હતું કરતાં હતું કરતાં કહ્યું હતું કરતાં હતું હતું કરતાં હતું હતું કરતાં હતાં હતું કરતાં હતુ આ હતાં હતાં હતું કરતાં કરતાં હતું કરતાં હતું કરતાં હતું કરતાં હતાં હતાં હતાં હતું કરતાં હતું કરતાં હતાં હતાં હ

ન આપશ. ૧૨કો વધમાં નોંધ કરી શકે છે કે કંપની દ્વારા તેની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી વિગતોને

જેશાયાંત્રી વધુમાં ત્યાં કરી શકે છે કે છે અની કુલ તેની વેબરાવીટ પર અપલોડ કરવામાં આંબેલી વિઝાગેને આ બાલે વી લોકોએ અને 19 માટે કરિયા કેવામાં ત્રાર કુલ્લા કરવામાં આ વિજ્ઞાસ કરવામાં આવેલી વિઝાગેને આપાલા બાલે બેશાયાં કેવામાં અંદા કરિયા કેવામાં અના વાતા કોળાવાના કોળાવાના કોળાવાના કેવામાં આ કોળાવાના કોળાવ 18. જા ત્રહે આક્રાભર, 2004 સુધામાં બંધાવિત શેરાવાઓ તરાવણી લીઇ માન્ય દાવો પ્રાયત ના થાય તો, વર્ધની અંદિઓની આવાળકાસનોનું પાલન કરવાના તેનુશી, નિસ્તામોન નિર્માણિત પોલન અનુસ્વાદ દાજની દર પાલાનાની શેર ટ્રાન્સફર કરવા પડશે. આ નિરામો અનુસાર દાજનાં કરાવો કરાવો કર્યા કરાકોશી આવી બિનાદાવેદાર કિવિક-કની રકમ અને શેરાના આંધામાં કંપની સાંભે કોઈ લાં કો કરવામાં આવતા તેના દાપાકેતના આંધાને કોઈ લાં કો કરવામાં આવતા તેને હોં કર્યા કર્યા કરે કરા કે શેરાના કરે કર્યા કરવા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કરવા કરવા કરવા કરવા કરવા કરવા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કરવા કરવા કરવા કરવા કર્યા કરવા કરવા કર્યા કર્યા કરવા કરવા કરવા કરવા કર્યા કરવા કરવા કરવા કર્યા કર્યા કરવા કરવા કરવા કરવા કરવા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કરવા કર્યા કર્યા કરમાં કર્યા કરવા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કર

022 62688200/222, ઇમિલ આઇડિંગ investor@bigsthareonline.com ભોડેલા આદેશથી સ્થળ : મુંબર્ઇ પનામા પેટ્રોકેમ સ્થિમીટેક માટે તારીખ : ૧૦.૦૦.૨૦૨૪ સહી/-, ગાયગી શર્મા, ઇપલી સેક્રેટરી અને અનુપાલન અધિકારી

આવેલી તાજી સુભાષચંદ્ર બોઝ મિશ્ર પ્રાથમિક શાળા ક્રમાંક ૧૫૯ માં પણ ત્રાતાના સાળા કરાક ૧૧૬ ના વસ બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયામાં જે રીતે પ્રક્રિયા થાય એ રીતે બાળકોને

પહેલાં જે ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રહેવાના હતા તે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકો દરેક વર્ગમાં પ્રચાર માટે પણ બાળકા દરક વળના પ્રવાર નાટ વજા ગયા હતા અને જેવી રીતે ભારતીય સંવિધાનમાં લોકશાહીએ આપણો અધિકાર છે એ મહત્વ સમજાવવા માટે બાળકોની ઇવીએમ દારા જેમ આપણે લોકશાહીમાં ચૂંટણી કરીએ છીએ એ પ્રકારની ચૂંટણી કરવામાં અનેલ હતી. બાળકોએ પૂરી પ્રક્રિયા જેવી રીતે આખું ચૂંટણી પંચ કાર્ય કરે એ જ રીતે શાળાના નાના બાળ સંસદોએ પ્રક્રિયાની નિભાવી હતી અને આ રીતે લોક બાળ સંસદની ચૂંટણી શાળામાં યોજાય હતી. વિજેતા જુડલાસાના મહારાહાતા.વિકલ બાળ સાંસદોને શાળામાં વિવિધ સમિતિના મંત્રી અને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવશે અને विधिवत तेमनी शपथविधि पण કરવામાં આવી હતી

માલિકે ઇશારો કરતા પાલતુ કૂતરાએ ૭ વર્ષની બાળકોને બચકું ભરી લીધું, ડોગ માલિક સામે ફરિયાદ

વડોદરા, વડોદરાના તરસાલીમાં મંગલા ગ્રીન સોસાયટીમાં રહેતા વર્ષાબેન પાંડેએ સાસાયટાના રહતા યુવાગાન વાડળ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે ૯:30 વાગે હું તથા મારી દીકરી અમારા ફ્લેટમાં નીચે વોકિંગ કરવા માટે નીકળ્યા હતા. તે વખતે અમારી સોસાયટીમાં રહેતા શશીકાંત મોગે તેમનું જર્મન શેફર્ડ પાલતુ કૂતરું લઈને નીકળ્યા હતા. અગાઉ પણ તેમના ડોગ બાબતે આ એપાર્ટમેન્ટના રહીશો સાથે ઝઘડો થયો હતો અને તેમના પત્નીએ ગત છક્રી જૂને એક મહિનામાં ડોગ હટાવી

દઈશું તેવી બાહેધરી આપી હતી. તેમ છતાં તેઓએ પોતાનો ડોગ બીજી જગ્યાએ શિક્ટ કર્યું નહોતું. સોસાયટીના તમામ રહીશો તેમન વિરુદ્ધમાં હોય તેઓ ગઈકાલે રાત્રે મારી સામે આંખો કાઢીને જોતા હતા અને મને તેઓ દારૂ જેવા કેફીનો નશો કરેલો હોય તેવું લાગ્યું હતું. શશીકાંતભાઈએ તેમના જર્મન શેકર્ડ ડોગનો પટ્ટો છોડી કંઈક ઈશારો કરી

અમારા તરફ દોડાવ્યું હતું. ત્યારબાદ તે ડોગ મારી પાસે આવી મારી દીકરીને જમણા પગના ઘૂંટણના નીચેના ભાગે બચકું ભરી લોહી લુહાણ કરી દીધી હતી. સોસાયટીના રહીશો ભેગા થઈ જતા શશીકાંતભાઈએ મને ધમકી આપી કહ્યું હતું કે તું મારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ ત્યારબાદ તેઓ તેમનું ડોગ લઈને

ભૌતિક કબ્જા નોટીસ

ક્રમ નં.	કરજદારો/ સહકરજદાર(રો)નું નામ/ લોન એકાઉન્ટ નંબર (ડીએચએકએલ જુનો લેન અને આઈસીઆઈસીઆઈ નવો લેન)	મિલ્કતની વિગત / કબ્જાની તારીખ	ડિમાંડ નોટીસની તારીખ / ડિમાંડ નોટીસની ૨કમ (રૂ)	શાખાનું નામ
٩.	નરેન્દ્ર શાંતિલાલ શાહ/ નિશાબેન નરેન્દ્ર શાહ- QZSUR00005027971 (જુનો ડિએચએફએલ એકાઉન્ટ નં. ૪૧૦૦૦૦૧૮૫૯)	કલેટ નં. ૧-૭/૪૦૨, શિવ સાઈ રેસીડેન્સી, ચલઘાલ રેલવે સ્ટેશન પાસે, ચલઘાલ- નિયોલ રોડ, મૌજે- વાંક્રનેડા, સુરત- ૩૯૪૩૦૫- ૦૭ જુલાઈ, ૨૦૨૪	૧૮ જૂન, ૨૦૨૧ ફા. ૧૩,૪૨,૮૫૭.૦૦/-	સુરત
	અમિતભાઈ અમિનભાઈ ચુડાસમા/રેખાળેન અમિનભાઈ ચુડાસમા-QZSUR00005035926 (જુનો ડિએચએફએલ એકાઉન્ટ નં ૪૧૦૦૦૦૮૮૯૭)	નાનસદ, કામરેજ, ગુજરાત, સુરત- ૩૯૪૨૧૦-	૦૯ જૂન, ૨૦૨૧ ટ્રા. ૧૯,૫૨,૧૯૪.૦૦/-	સુરત
3.	ભવાનભાઈ સોલંકી- QZSUR00005036336	લોટ નં. ૪૮, વ્રજ નંદિની રેસીડેન્સી, વિભાગ-ર, સીબીએસ યબ્લિક સ્કુલ પાસે, દાદા ભગવાન પાસે, મૌજે- નાનસદ, કામરેજ, બ્લોક નં. ૮૧/૧, ગુજરાત સુરત-૩૯૪૧૮૦-૦૭ જુલાઈ, ૨૦૨૪	31.	સુરત
٧.	સુભેન્દ્રકુમાર લાલુપ્રસાદ યાદવાયનોતી દેવી યાદવ- QZSUR00005040460 (જુનો ડિએચએફએલ એકાઉન્ટ નં.૪૧૦૦૦૦૮૭૪૭)	પ્લોટ નં.૨૮૩, રાજમંદિર રેસીડેન્સી, મહાદેવ વિલા પાછળ,કડોદરા બારડોલી રોડ મૌજે તાટીથૈયા, પલસાળા, સુરત- ગુજરાત, સુરત- ૨૨૦૩૦૯- ૦૭ જુલાઈ, ૨૦૨૪	૧૮ જૂન,૨૦૨૧ રૂા. ૧૩,૦૫,૯૭૧.૦૦/-	સુરત

ઉપર જાયાલેલા કરજકાર(ચી) જામોનાકાર(ચી) અહીં બાદી નાલાં પરત કરી જયા માટે 30 દિવસની નાંટીસ આપવામાં આવે છે. નહીં તા કાબર અન્દ ઇન્ટરેસ્ટ (ઈન્સેનિએ) ગુર, ૨૦૦૨ને જોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિસ્તન આ નોટીસ પ્રચિત્ર થયાનાં 30 દિવસ બાદ એવી દેવામાં આવશે તારીએ: 11 જુંલાઈ, ૨૦૨૪ ત્યાર સુરત સ્થાપ : સુરત

તાપી માતાના જન્મ દિવસની તૈયારી: સુરતના જહાંગીરપુરા ખાતે તાપી માતા પ્રાગટ્ય દિવસે ૧૧૦૦ મીટર લાંબી યુંદડી અર્પણ કરાશે મુરત અપાઠ સુદ સાતમ એટલે કે ઓવારા અને ઉનારા પર સકાઈ ૧૩મી જુલાઈના ઇસ સુરતની અભિયાન કરીને કચરો ઉલેવવામા ભાવારોઈ એટી તાપી માતાનો આવ્યો હતો.

સુરત અષાઢ સુદ સાતમ એટલે કે ૧૩મી જુલાઈના રોજ સુરતની જીવાદોરી એવી તાપી માતાનો પ્રાગટ્ય દિવસ છે. વિશ્વમાં તાપી એક ડેના ત્યે એ એને વ્યાનિશે ધામધમ એવી નદી છે જેનો સ્થાનિકો ધામધુમ પર્વક જન્મ દિવસની ઉજવણી કરે છે સુરતમાં તાપી માતાના જન્મ દિવસની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જહાંગીરપુરાના પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ પર ૧૧૦૦ મીટર લાંબી ચુંડદી અર્પણ કરવામા આવશે. તાપી માતાના જન્મ

આવ્યા હતા. સુરતએ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને તેના માટે સુરતને સૂર્યપુર કહેવાય છે. સુરતમાં તાપી નદીના વિવિધ ઓવારા પર તાપી માતાના જન્મદિવસની ઉજવણી ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીના પ્રાગટ્ય દિવસે સુરતમાં કુરૂક્ષેત્ર ધામના પૂજયમોટા સુર્યોદય યાટ પર મા તાપી નદીને ૧૧૦૦

બિલ્ડીગ બનાવવામાં આવ્યા છે. આ આવાસના ડી-બિલ્ડીંગમાં

સંસ્થાઓએ આ ઘાટ પર સકાઈ કરીને ધાટની સફાઈ કરી હતી.

તાપી માતા જન્મ દિવસની ઉજવણી પહેલાં કુરુશેત્ર ટ્રસ્ટ પૂજય મોટા સૂર્યોદય ઘાટ ઉપર સફાઈ ઝુંબેશમાં રવિવારના રોજ ૧૦૦ જેટલા કાર્યકરો જોડાયા, ગુરુકુળ સ્કૂલ, મોરાભાગલ, ગાયત્રી સ્કૂલ, મોરાભાગલ, ગાયત્રી પરિવાર, રાંદેર પીપલ્સ બેંક, સુરત



સુરતમાં રાંદેર ઝોનના સુમન વંદન આવાસમાં ૭૦ ફ્લેટમાં ભાડુઆતનો ગેરકાયદે કબ્જો



સુરત, સુરત પાલિકા અને સરકાર દ્વારા લોકોને ઘરના ઘર મળે તે માટે વિવિધ યોજના હેઠળ શહેરમાં બનાવેલા આવાસમાં કેટલીક જગ્યાએ ગેરકાયદે ભાડુઆતને આપી દેવામાં આવ્યા છે. લાંબા સમયથી વેસુના આવાસમાં ભાડુઆતોની વધતી સંખ્યા લાભાર્થીઓ માટે આફતરૂપ બની રહી છે તેવી અનેક ફરિયાદ બાદ અચાનક પાલિકા તંત્ર જાગ્યું છે. હાલમાં રાંદેર ઝોનના આકારણી વિભાગે એક સર્વે કર્યો હતો તેમાં સુમન વંદન આવાસમાં ૭૦ ફ્લેટમાં ભાડુઆતનો ગેરકાયદે કબ્જો હોવાનું બહાર આવ્યું છે. ઝોન દ્વારા ભાડુઆતને નોટિસ આપી ફ્લેટ ખાલી

કરવા તાકીદ કરી છે. સુરત પાલિકા વિસ્તારમાં સુરત પાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત અન્ય આવાસ યોજના હેઠળ હજારો આવાસ બન્યા છે. સુરત પાલિકાના અઠવા ઝોનમાં રાહુલરાજ મોલ પાછળ પ્રધાનમંત્રી

પાલી દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર એલર્ટ : જર્જરિત માનદરવાજા ટેનામેન્ટના નળ-ગટરના કનેક્શન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાપવાનું શરૂ

સુરત, સુરતના સચિન વિસ્તારમાં પાલી ખાતે દ માળની મકાન હોનારતમાં ૭ લોકોએ જીવ ગુમાવ્યાની દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર ચોંકી ઉઠયં યાલકા તંત્ર યાકા હઠ્યું છે. શનિવારની દુર્ઘટનાને પગલે સુરત પાલિકાના લિંબાયત ઝોને માનદરવાજા જર્જરિત ટેનામેન્ટના નળ અને ગટર જોડાણ કાપવાનું શરુ કર્યું છે. સોમવારે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ુ ઝોનની ટીમ માન દરવાજા પહોંચી હતી અને લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સચીન પાલી મકાન હોનારત

બાદ પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહી આવવાનો નિર્ણય કરી લીધો છે. લાંબા સમયથી રીંગરોડ માનદરવાજા જર્જરિત ટેનામેન્ટનો મદ્દો પેન્ડીંગ છે રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબુરી જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું. પરંતુ પાલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી

સુરત પાલિકાના લિંબાયત ઝોને આજે ૧૫૦ પોલીસનો બંદોબસ્ત અને ૨૦૦થી વધુ પાલિકાના કર્મચારીઓ, સિક્યુરિટી સહિતનો સ્ટાફ સાથે માનદરવાજા ટેનામેન્ટ પહોંચી ગયા હતા. સવારથી જ પાલિકાએ આ જર્જરિત ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી

પાલિકાની આ કામગીરીનો વિરોધ્ કરીને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી જ મકાન ખાલી કરીશું તેવી માગણી કરી હતી. પરંતુ આ વખતે પાલિકા તંત્ર મસ્લમ છે અને કોઈ યાલકા તંત્ર મક્કમ છે અને કાઇ જોખમ લેવા માગતા ન હોવાથી નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી છે.

લાભાર્થીઓની સાથે ભાડુઆતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે જેના કારણે બિલ્ડીંગમાં અને ક સમસ્યા થતી હોવાથી સુમન મલ્હાર ડી-બિલ્ડીગમાં નિયમ વિરુદ્ધ રહેલ

કરવા પાલિકાના એકોર્ડેબલ હાઉસીંગ સેલને ફરિયાદ કરી છે. પરંતુ કોઈ પગલાં હજી સુધી કરવામાં આવ્યા નથી. મહાનગરપાલિકાએ બનાવેલા સુમન વંદન–૧ અને સુમન વંદન–૨માં છેલ્લા ઘણા સમયથી ભાડુઆતો વસવાટ કરતા

રાંદેર ઝોનના આકારણી વિભાગે હાલમાં સર્વે કર્યો હતો. આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુમન વંદન-૧માં ૯ ભાડુઆતો વસવાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને આ રીતે જ સુમન વંદન ૨માં ૬૧ ફ્લેટોમાં ભાડુઆતો વસવાટ કરી રહ્યા ઝોનમાં બનેલા બંને આવાસોમાં ૭૦ જેટલા પરિવારો ગેરકાયદેસર રીતે હોવાનું બહાર આવતાં પાલિકાએ ભાડુઆતને નોટિસ આપી છે અને ગેરકાયદે ભાડે રહેતા હોવાથી આવાસ ખાલી કરવા માટે તાકી કરી છે.

SHREE AJIT PULP AND PAPER LIMITED Registered Office: Survey No. 239 Mars Married Tollars.

Registered Office: Survey No. 239, Near Moral Railway Crossing, Village Salvav, Via-Vapi, Valsad - 396191, Gujarat, India Contact person: Chinmay Methiwala, Company Secretary & Compliance Officer Telephone: +91 260 6635700 | E-mail it investors@shreeqii.com | Website: www.shreeajit.com Corporate Identity Number: L21010GJ1995PLC025135

FIRST AND FINAL CALL MONEY NOTICE TO THE HOLDERS OF PARTLY PAID-UP EQUITY SHARES (ISIN: IN9185C01015) HELD AS ON THE RECORD DATE I.E., FRIDAY, JULY 05, 2024.

In terms of the letter of offer dated January 15, 2024 ("Intert of Offer"), the Company had issued partly paid-up equity shares, on a rights basis, to its shareholders at an issue price of 180 each including a share premium of 270 per rights equity share, in the ratio of 2 (two) right equity shares for ever paid-up shares held as on the record date i.e. Thursday, January 18, 2024, in accordance with the terms of the issue as mentioned in the Letter of Offer, the Company had received ₹48 (comprising ₹6 towards face value a

so.r.1.s. so distanding party paid-up equity shares of face value Y10 each, issued by the Company, on a rights basis, pursuant to the Letter of Offec.

The Board has five firtidary, sluy 50, 2024 as the record dien ("Record Date") for the purpose of determining the holders of party paid-up equity shares to whom the notice of the First and Final Call Notice", will be sent. The Company has intimated the Record Date to the Stock Exchange on June 27, 2024. Accordingly, in terms of provisions Companies Act, 2013 (Face) send with relevant rule made thereigned and the Letter of Offer, the First and Final Call Notice has been sent in electronic mode to the holder of party paid up equity shares whose e-mail addresses are registered with Company or its Registra and Transfer Agent ("RITA") or Depository Participant ("D") as on the Record Date is. Firtidary, sluy 60, 2024. Further physical copy of First and Final Call Notice along the indicated through permitted modes at the registered address of those shareholders: a. who has not represent the end of the company or its RTA or Depository Participant("p) or who has specifically registered their expects for the hard copy of the same."

Amount Due	K 32 per partly paid-up equity snare neid by snareholders as on the necord Date			
Call Payment Period	From	То	Duration	
Gall Payment Period	Monday, July 15, 2024	Monday, July 29, 2024	15 days	
	(a) Online ASBA	Through the website of the SCSBs ⁽¹⁾		
	(b) Physical ASBA	By submitting physical application to the Designated Branch of SCSBs ⁽¹⁾		
	(c) Online	Using the 3-in-1 online trading-demat-bank account whenever offered by brokers		
Modes of Payment	(d) Cheque / Demand raft (made payable to)	Shree Ajit Pulp and Paper Ltd - First and Final Call Money – Escrow Collection – R A/C (for resident shareholders). Shree Ajit Pulp and Paper Ltd - First and Final Call Money – Escrow Collection – NR A/C		
		(for non-resident shareholders)	Jan Money - Escrow Conection - NT A/C	

in une case snarentoeres encose to pay through Cheque / D0, the sayment sile (stating full Name of the Sole/First shareholder, First and Final Call Notice No. 2 Pt Ocient (D7-field No., and No. of party paid-up equity shares, along with the amount payable by cheque or demand darf must be presented at the following locations on or before Menday, July 29, 2024:

For Resident

Shareholders

Ammediand: Shareholders

And Shareholders

Ammediand: Shareholders

And S

ISIN-IN-185001017, allotted by depositories.

Iv. In case of non-receipt of the First and Final Call Notice, shareholders can request by e-mail or letter, for the duplicate First and Final Call Notice to the Registrar or may also download the same from the Company's website: www.shreagit.com or the Registrar's website: www.linkintims.co.in. in such a case, however, the shareholder need to fill the DP ID-Client ID, number of partly paid-up equity shares held and amount payable towards the First and Final Call Money.

V. The shareholder must mention in the Application, hisher PAN number allotted under the income Tax Act, 1961.

All correspondence in this regard may be addressed to:

Link Intime India Private Limited
C101, 1st Floor, 247 Park, LBS Marg,
Viktroli (West), Murmbai - 400083, Maharashtra, India,
Telephone: +91 810 811 4949
Emili: sappl.callmoney@linkritime.co.in | Website: www.linkintime.co.in
Investor Grievance Email: sappl.callmoney@linkritime.co.in

For SHREE AJIT PULP AND PAPER LIMITED